

August 11, 2023

श्रावण (अधिक)- कृष्ण पक्ष, एकादशी विक्रम संवत, २०८०

National Stock Exchange of India Limited "Exchange Plaza" Bandra – Kurla Complex, Bandra (E), Mumbai – 400 051 NSE Code: GHCLTEXTIL

BSE Limited
Corporate Relationship Department,
1st Floor, New Trading Ring, Rotunda Building,
P.J. Towers, Dalal Street,
Fort, Mumbai – 400 001
BSE Code: 543918

Dear Sir/Madam,

# <u>Sub: filing of published copy of newspapers for Intimation of 3<sup>rd</sup> Annual General meeting</u> and Cut-off date for AGM

In continuation to our earlier communication dated August 10, 2023 and pursuant to requirement of Listing Regulations read with other applicable provisions, if any, please find enclosed herewith copy of advertisement released in The Hindu - Business Line (English) dated August 11, 2023, The Economics Times (English) - Ahmedabad edition dated August 11, 2023, and Jai Hind (Gujarati) dated August 11, 2023.

Please note that copy of this intimation is also available on the website of BSE Limited (<u>www.bseindia.com/corporates</u>), National Stock Exchange of India Limited (<u>www.nseindia.com/corporates</u>) and website of the Company (<u>www.ghcltextiles.co.in</u>).

You are requested to kindly take note of the same.

Thanking you

Yours faithfully

For GHCL Textiles Limited

Lalit Narayan Dwivedi Company Secretary



GHCL Textiles Limited (Formerly Sree Meenakshi Mills)

GHCL House, B- 38, Institutional Area, Sector- 1, Noida- 201301 (U.P.), India. Ph.: +91 - 120 - 2535335, 4939900, Fax: 91- 120- 2535209 CIN: U18101GJ2020PLC114004, E-mail: info@ghcltextiles.co.in, Website: www.ghcltextiles.co.in

### SC ruling may provide fillip to FCCB issuances

The Supreme Court on Tues-day dismissed the Revenue Department's Special Leave Petition against the Bombay High Court's Judgment with regard to conversion of foreign currency bonds (FCCBs). convertible

### ANALYSIS.

The apex court turned down the revenue department's assertion that deate of acquisition of the bonds should determine the cost of acquisition, rather than the date of acquisition or the underlying shares.

The decision may give a fillip to FCCB issuances and make it more attractive to in-

make it more attractive to in-vestors, said experts. Indian companies issue these con-vertible bonds abroad to raise money in foreign currency.

money in foreign currency.

1993 SCHEME

"The SC decision affirms the tax position of the 1993 scheme, which covered both PCCBs and ADPS/GDPs. The tax position of the 1993 scheme, which covered both process are viewed to the process well as issuers," aid Surill Badala, Partner and Head, Financial Services, Tax, KPMG in India. The matter pertains to Kingfisher Capital's subscription to Zero Coupon FCCBs in the Indian company NBVL in 2006, and the subsequent sale of shares received from the conversion of these PCCBs. The apex court observed that the bonds were issued under the 1993 scheme, which governs the issuance of FCCBs, and not the 2008 scheme, which pertains for foreign Currency Exchangeable Bonds. The special body in the provision of the service of such specific taxing provisions, the tax treatment provided by the 1993 scheme would legitimately apply," said Punit Shah, partner, Dhriva Addvisors. "This will clear the

Apollo Tyres on Thursday re-ported a consolidated net profit of ₹397 crore for the quarter ended June 30, a more than double (124 per cent)

growth on a year-on-year basis compared with ₹177.3 crore in the corresponding period last

the corresponding period last year.

The total income of the company also rose by 5.51 per cent y-o-y to ₹6.280 crore during the quarter in review compared with ₹5.952 crore in the April-June quarter last year. The company's European operations performed better

Apollo Tyres Q1 net more

than doubles to ₹397 crore

SBI Card enables RuPay

credit cards on UPI

### WHAT IS AN FCCB?

making regular coupon and principal payments and

provides investors with an option to

Upon maturity, holders can convert the equivalent value of equity at a set

doubts regarding the taxabil-ity of gains on 1993 scheme bonds and mitigate future lit-igation."

igation."
A scheme for issue of FC-CBs and Ordinary Shares (through Depositary Receipt Mechanism) was notified in 1993 to allow the Indian com-

1993 to allow the Indian com-panies to raise money over-seas through issue of PCCBs and global depository receipt mechanism (GDR) and Amer-

and gloot depository (eetpi mechanism (GDR) and Amer-ican depository receipt mech-nism (ADR). As per the 1993 scheme, the price of the shares on the date of conversion is to be be con-sidered as the cost of acquisi-tion. Say the FCCB was priced at \$5, which turned into \$10 on the date of conversion of the bond into shares. So, \$10 is the cost of faccinations of the condition of the shares.

the cost of acquisition, and not

the original price of purchas-ing the bond. So, there is a step up of cost on conversion date because the price has moved

because the price has moved up.

The Bombay High Court had earlier ruled that the computation of capital gains should be determined from the date of conversion of FC-CBs into shares, and not the date of acquisition of the FC-CBs. This was challenged by the Revenue Department.

than the market under a tough scenario, while in India the fo-cus remained on higher mar-gin products and markets, it said.

"My compliments to the

team in Europe for outper-forming the market, despite the ongoing challenges. In In-dia, we have done well in the

dia, we have done well in the key replacement market seg-ment, while focusing on en-riching our product and mar-ket mix for better portiability, from a long-term perspect-ive," Onkar Kanwar, Chair-man, Apollo Tyres, said.

This, along with stable in-put costs, have resulted in bet-ter margins in the past unsurer breadded

ter margins in the past quarter, he added.

• FCCB is a special type of debt instrument issued in foreign currency

anomalies in Pratt & Whitney (P&W) engines, Indian carrier IndiGo is set to send 13 engines to the US-based manufacturer for inspection. According to sources, the Directorate General of Givil Aviation (DGCA) has assured minimal disruption to domestic carriers during the peak season, addressing wor-It is a bond with a dual character of debt and equity instrument
 It acts like a bond

Amid concerns over material anomalies in Pratt & Whit-

ries surrounding the ongoing global engine anomalies.

With 15 engines anomalies of the original origi



DGCA sees minimal impact on IndiGo fleet due to P&W engine anomalies

conduct an angle ultrasonic scan inspection during the shop visit, and the engines are required to be submitted for inspection before September 15. While this de-

velopment might raise con-cerns about potential disrup-tions during the upcoming travel season, a senior offi-cial from the airline reas-sured that there will be little to no impact on the capacity of Indian carriers.

GLOBAL IMPACT
Pratt & Whitney has pinpointed 200 PW1100G engines, including those of IndiGo and Go First, for
immediate inspection. This
initial wave of inspections is

set to be completed by mid-September. P&W had stated than around 1,000 more PW 1100 engines will need to be inspected within 9-12 months. This broader in-spection could potentially impact up to 600 aircraft globally. IndiGo's CFO, Gaurav Negi, emphasised the collaborative efforts to min-imise any potential fleet dis-ruptions. "We are working with the OEM to assess and minimise any potential im-pact on our fleet," he stated.

### **QGHCL**

GHCL Textiles Limited

Regd. Off.: GHCL House, Opp. Punjabi Hall, Navrangpura, Ahmedabad-380009 (Gujard). Email: info@gncllextilles.co.in; Website: www.ghclextilles.co.in pura, Ahmedabad-380009 (Gujarat). Phone : 079-26434100, Fax : 079-26423623 .co.in; Website : www.ghctextiles.co.in (CIN: U18101GJ2020PLC114004)

NOTICE OF 3RD ANNUAL GENERAL MEETING, REMOTE E-VOTING INFORMATION AND CUT-OFF DATE

NOTICE OF 3RD ANNUAL GENERAL MEETING, REI

NOTICE is hereby given that 3rd-Annual General Meeting (ACM) of the Company will be hald on Thursday, September
21, 222 3 (years, 11, 1224 years, 1224 year

- Ordinary Business:

  1. Adoption of audited standaione financial statements of the Company for the financial year ended March 31, 2023, and
  the reports of the Board of Directors and auditors thereon along with other necessary reports.
- cointment of Mr. Raman Chopra as a Director of the Company, liable to retire by rotation

- Suestim DURATIONS (2)

  3. Approval for appointment of Dr. Manoj Valsh (DIN: 00157082), as an independent Director of the Company.

  4. Approval for appointment of Mrs. Vijaylaxmi Joshi, Ex-IAS (DIN: 00032055), as an independent Director Office (2)

  the Company.
- una-company.

  Approval for appointment of Mr. Arun Kumar Jain, Ex-IRS (DIN : 07563704), as an Independent Director of the Company.

Relification of rem.nesition of Cost.Auditors.

Tip the nemote -evoluty period, members of the Company, holding shares as on the cut-off date i.e. Thursday, released to the cut-off date i.e. and the cut-off date i.e. (\$51) on which each conjugate cut-off date i.e. and the cut-off date i.e. a

share in demat mode
Presunt to SEB (Cruzia no. SEB)HOCFD/CMD/CRP/2020/242 dated December 9, 2020 on e-Voting facility
provided by Listed Companies, Individual Mambers holding securities in demat mode are allowed to vota through their
demat account maintained with Depositories and Depository Participants. Members are advised to update their mobile
number and remail bit in their demat accounts in order to access e-Voting facility.

runner are neares in the free fedings of the voting process, at the Denta account holders, by wey of a single login in order to increase the efficiency of the voting process, all the Denta account holders, by wey of a single login credential, through their Dental accounts! websites of Depositorised Depositoriey Participants, able to cast their vote without having to register again with the e-voting services providers (ESPs), threety, not only facilitating seamless authentication but able on that micrograms and convenience of participating in e-voting process.

Pursuant to said SEBI Circular, login method for e-Voting and joining virtual me nas for Individual Members holding

Securities in Delitatinicae (14000 000) is given bolow.			
Type of Members	Login Method		
Individual Members holding securities in	<ol> <li>Users who have opted for CDSL Easi / Easiest facility, can login through their existing user id and password. Option will be made available to reach e-Voting page without any further authentication.</li> <li>The users to login to Easi / Easiest are requested to visit CDSL website <a href="https://www.cdslindia.com">www.cdslindia.com</a> and click on login icon &amp; New System Wyeasi Tab.</li> </ol>		
Demat mode with CDSL	2) After accessful foigh the East/ Easiest user will be able to see the 4-foling option for eligible comparies where the evoling is in process as per the information provided by comparing. On clinicing the evoling caption, the user will be able to see 4-briding page of the 4-foling service provider for easifing your vote during the remote 4-briding parties provider for thing parties provider for thing parties provider for thing parties provider. Set for all providers, but the user can visit the 4-foling parties providers, but the user can visit the 4-foling parties providers whethis directly.		
	<ol> <li>If the user is not registered for Easi / Easiest, option to register is available at CDSL website www.cdslindia.com and click on login &amp; New System Myeasi Tab and then click on registration option.</li> </ol>		

also to circusy access me system or as 4-coning solvertor as 14-coning solvertor by 19 your are leavely presented for NSDL. DASA Satility, please visals the e-Services website of NSDL. Open web however by lyting the following URL: <a href="https://diservices.nsdl.com">https://diservices.nsdl.com</a> after on a Personal Competer or an enable. Once the home page of e-Services is launched, dicks on the Service Annual Competer or an enable. Once the home page of e-Services is launched, dicks on the Service Annual Competer or an extra several open. To compete or an extra several open. To compete or an extra several present of the services and services and present on the services and services. Dicks on "Access to the Violing services and services and you will be not effected to e-Violing page. Citics on compeny manual evid-burg services provides and you will be not effected to e-Violing services provides website to reasting you viole during the remote e-Violing period original your time hereafted viole youther through the present of the provides and the provides and

withuil meeting & coting during the meeting.

If the user is not registered for IDAS — Services, option to register is available at his purpose of the property of the propert

to a Volting service provider website for casting your vols during the mende a Volting period or joining voltaml inselling & voltage during the meeting. You can also login using the loging during the meeting significant with MSDL/DSL for a Volting facility. After Successful (pgin, you will be able to see a Volting griders with MSDL/DSL for a Volting facility. After Successful (pgin, you will be able to see a Volting griders with MSDL/DSL for a Volting facility. After Successful (pgin, you will be a developed to you griders with MSDL/DSL for a Volting facility of your and you will be a developed to your does not not not consider that you will be undirected to a Volting service provider website for casting your does during the remote "After griders of your will be undirected to a Volting service provider website for casting your does during the remote "After griders" of your will be undirected to a Volting service provider website for casting your does during the meeting.

Step 2:Access through CDSL e-Voting system in case of non-individual shareholders in der Login method of e-Voting for Members (including HUF) other than individual Members.

(i) Log on to the e-voting website www.evotinginda.com

- Now Enter your User ID a. For CNSL. 18 (digits beneficiary ID, b. For NSSL. 8 Character IP ID followed by 8 Digits Client ID. b. For NSSL. 8 Character IP ID followed by 8 Digits Client ID. Nox enter the flue age Verification as displayed and Click on Login If you are holding shares in Demat form and had logged on to we dray company, then your existing password is to be used. If you are a first time user follow the steps given below:

Place : Noida Date : August 10, 2023

PAN\*
Enter your 10 digit alpha-aruments "PAN Issued by Income Tax Department (Applicable for demat Members,)
Members who have not updated their PAN with the Company/Depocatory Participant are requested to be the Company IRTA.

Dividend Bank
Enter the Dividend Bank Details or Date of Birth (in defirmity) from Company IRTA.

Date of Birth

- Click on the "RESOLUTIONS FILE LINK" if you wish to view the entire Resolution details
- Clack on the Resolution for the Links, tryou was now an entire resolution to the second of the resolution you have decided to vide on clack on "SUBMIT". A confirmation box will be displayed. If you wish to confirm your vote, click on "OK", else to change your vote, click on "CANCEL" and accordingly modify your vote.

  Once you "CONFIRM" your vote on the resolution, you will not be allowed to modify your vote.

- (wi) Uncertainty of Uncertainty of Uncertainty of Uncertainty, of Uncertainty of

Note for Non-Individual Members and Custodians for remote votins only:

Step 1: Non-individual Members and Custodians for remote votins only:

Step 1: Non-individual Members (a. other than Individuals, NLF; NRT etc.) and Custodian are required to log on to

Step 2: A scanned copy of the Registration From bearing the stamp and sign of the entity should be enabled to

helotiske strong decisionistication.

Step 2: A far receiving decisionistication for the seconding for which they wish to scleen.

Step 3: After receiving the login details a Compliance buter should be created using the admin login and password. The

Compliance buter words do able in line the accounting forwish they wish to scleen.

Step 4: Examed copy of the Beard Receivation and Power of Allorey (POA) which they have beaued in proor of the

Step 5: A scanned copy of the Beard Receivation and Power of Allorey (POA) which they have beaued in proor of the

Step 5: A scanned copy of the Beard Receivation and Power of Allorey (POA) which they have beaued in report of the

Step 5: A scanned copy of the Beard Receivation and Power of Allorey (POA) which they have beaued in report of the

Step 5: A scanned copy of the Beard Receivation and Power of Allorey (POA) which they have beaued in revolution and Power of Allorey (POA) which they have beaued in revolution and Power of Allorey (POA) which they have beaued in revolution and Power of Allorey (POA) which they have beaued in the POA.

\*\*\*\*\*\*Exemption\*\*\* The Poard Poard Poard Poard Poard Power of Poard Po

Step 6: Alternative, Non Individual Members are required to send the release in the scrumzer to verify the same.

Step 6: Alternative, Non Individual Members are required to send the relevant Board Resolution Authority letter etc. together with attested specimen signature of the duty authorized signatory who are authorized to vote, at least 48 hours before the meeting to the Company at <u>secretarial (Signation scrum</u>) violated more individual tab & not uploaded same in the CDSL - voting system for the scrutificate to verify the same.

uponaced same in the CUSL e-verify system for the excultance for verify the same.

The procedure verifying on the day of the AGM on e-verifing system are as under;
The procedure for e-Voting on the day of the AGM is as sense as the instructions mentioned above for Remote e-voting,
the since the VCDMH to attain meeting with the available where the ECRN of Company will be displayed after
Shareholders who have voted through Remote e-Voting will be eligible to attend the meeting. However, they will not be eligible to water the AGM.

ble to vote at the AGM. Olders are encouraged to join the Meeting through Laptops / IPads for better experience. shareholders will be required to allow Camera and use Internet with a good speed to avoid any disturba

Further shareholders will be required to allow Camera and use nearms war a good speece as the court of using the meeting.

Please note that Participant Connection from Mobile Devices or Tables or through Labory connecting via Mobile recommended to the third process. It is therefore recommended to the control from the connection from the connection of t

questions during the meeting.

Only those Members's Michaelse who will be present in the AGM through VCIOAVM facility and have not casted their vote on the Resolutions through remote a-Voting and are otherwise not bernot from during or, shall be eighble be vote. The Resolutions through remote a-Voting and are otherwise not bernot from during or, shall be eighble be vote. The remote are through the average vote that the properties of the remote properties of the average vote the remote properties of the members branched be considered minutia as the facility of e-voting viriling the remote properties of the members propriesping in the meeting through VCIOAVM facility. Year the votes cast by such members shall be considered minutia as the facility of e-voting viriling the remote propriesping in the meeting. Members who have voted through Remote a-Voting will be eligible to attend the AGM. However, they will not be eligible to vote at this Voting viriling the remote propriesping in the meeting.

required to what as are return.

Clause for members for attending the AGM through VC/QAVM are as under;

Whenber will be provided with a facility to attend the AGM through VC/QAVM through the CDSL e-voting system.

Members may access he same as <u>https://www.ord.cnind.com</u> under Members / members login by using the remote e-voting conderniate. The link for VC/QAVM will be available in shareholdsrimembers login where the EVSN of Company will be displayed.

include a-found protectimates: most of Voculowan was available in institutional immediates again where the exercision of company with the displayed.

Company with the displayed is purposed to allow Carteria and use Internet with a good speed to avoid any disturtance uniting. Membridge was not prequired to allow Carteria and use Internet with a good speed to avoid any disturtance uniting the Meeting, and a second control of the protection of

:::

Login type	Helpdesk details
Individual Members holding securities in Demat mode with CDSL	(a) If you have any quaries or issues regarding attending e-voting from the e-voting system, may writer the Frequentity Asked Questions (FAGS) <sup>2</sup> and e-voting manual series away series from the evoling manual series evol

manner. The Board has also authorised NAP to appoint one or more sort unlined a voltage posses in a fair and transparent manner. The Board has also authorised NAP to appoint one or more sort unlinears in addition to another injustic of NA: Hustral. The Scrutinizer staff, immediately after the conculsion of voltage the general meeting, instruction to the concussion of voltage the general meeting, instruction to the voltage cast of the meeting, thereafter unlock the voltage cast through remote a-voltage in the presence of all test two witnesses not in emerity and the voltage of the presence of the staff of the voltage cast of the voltage of the presence of the staff of the voltage of the v

res are requested to send their queries, if any, at least seven days in advance of the meeting so that the information

For GHCL Textiles Limited Lalit Narayan Dwivedi Company Secretary Membership No. F10487

ÇM (

SBI Card, the country's largest pure-play credit card issuer, and the National Payments Corporation of India have announced the linking of SBI credit cards on the Rul'rapplatform with the Unified Payments Interface (UP). Starting Thursday, SBI Card UP) transactions through their credit cards issued on Rul'ray. The functionality can be availed through registering the credit card with third-party UPI apps. This will further enhance the avenues for customers using SBI Card on the Rul'ray platform at UPI merchants, thus facilitating an enhanced and seamless payments experience.

Cardholders can ento their cardinate (Pay Intransactions) using their credit cards. This facilitating an enhanced and seamless payments to merchants (Pay Itansactions) using their credit cards. This facilitating an enhanced and seamles payments to merchants (Pay Itansactions) using their credit cards. This facility is free for customers. Rama Mohan Rao Amara, MD and CEO, SBI Card, side

KR Srivats

Rama Mohan Rao Amara, MD and CEO, SBI Card, said, "With this functionality, SBI Card customers will be able to use their SBI Card-issued



RuPay credit cards on the UPI platform. Today, UPI has be-come a massive digital plat-form, enabling millions of transactions every day".

FLEXIBILITY

This should give SBI Card cus-tomers greater flexibility and mobility along with hassle-free usage, he added. With this, the

usage, he added. With this, the industry is going to witness a significant increase in credit card usage, Amara noted.
Dilip Asbe, MD & CEO, NPCI, said, "The addition of SBI RuPayGredit Cardson UPI rails is a big milestone in the growth trajectory of digital payments in India. This partnership will enable seamless UPI payments for SBI RuPay credit cardholders, providing a digitally enabled credit card lifecycle experience".

# White-label ATM Leader, Indial Eyes a Slice of Fintech

ICICI Ventures-backed firm offering switching services to smaller banks and also working as digital loan facilitator: CEO

**KSRINIVAS** 

Gayathri.Nayak @timesgroup.com

Mumbai: ICICI Ventures-backed Indi1 is set to transform itself into a fintech company from being the top white-label ATM services provider. While the fintech businesses could take time to deliver profits, the ATM business keeps ringing in the cash.

'We are looking at revenue streams beyond white-label ATMs." said K Srinivas, managing director and CEO of Indial Payments. "Besides providing switching services to smaller banks to con-

also working as a digital loan facilitator by connecting our 54 million customers who are already on our digital platform to potential

lenders," he added.

Indial Payments, in which ICICI Ventures has about 49% stake, is promoted by Australia's Banktech group. The company plans to leverage its customer base using its white-label ATM platform by being an account aggregator and connecting those interested in small-ticket loans with the potential lender. This could earn the company a fee-based income for



has a significant presence in Tamil Nadu and is looking at strengthe-

ning its presence in other states such as Uttar Pradesh and Bihar, where ATM penetration is low

the concluded transactions.

providing white-label ATMs in semi-urban and rural areas where it is already having a strong presence and increase its ATM network and expand its regional

Indial Payments currently manages 12,200 white-label ATMs throughout the country and plans to double the count by rolling out another 12,000 more ATMs over the next five years.

The company has a significant presence in Tamil Nadu and is looking at strengthening its pre-

For other than individual shareholders holding shares in Demat

Enter the Dividend Bank Details or Date of Birth (in dd/mm/yyyy format) as recorded in your

to use the sequence number sent by Company / RTA or contact Company / RTA.

Members holding shares in demat form will now reach 'Password Creation' menu wherein they are required to

mandatorily enter their login password in the new password field. Kindly note that this password is to be also used

by the demat holders for voting for resolutions of any other company on which they are eligible to vote, provided

that company opts for e-voting through CDSL platform. It is strongly recommended not to share your password

On the voting page, you will see "RESOLUTION DESCRIPTION" and against the same the option "YES/NO" for

voting. Select the option YES or NO as desired. The option YES implies that you assent to the Resolution and

After selecting the resolution you have decided to vote on, click on "SUBMIT". A confirmation box will be

displayed. If you wish to confirm your vote, click on "OK", else to change your vote, click on "CANCEL" and

If Demat account holder has forgotten the changed password then Enter the User ID and the image verification

(xiv) You can also take out print of the voting done by you by clicking on "Click here to print" option on the Voting page.

(xvi) There is also an option to upload BR/POA if any uploaded, which will be made available to scrutinizer for

Step 1: Non-Individual Members (i.e. other than Individuals, HUF, NRI etc.) and Custodian are required to log on to

Step 2: A scanned copy of the Registration Form bearing the stamp and sign of the entity should be emailed to

Step 3: After receiving the login details a Compliance User should be created using the admin login and password. The

Step 4: The list of accounts linked in the login will be mapped automatically & can be delink in case of any wrong mapping.

Step 5: A scanned copy of the Board Resolution and Power of Attorney (POA) which they have issued in favour of the

Step 6: Alternatively, Non Individual Members are required to send the relevant Board Resolution/ Authority letter etc.

together with attested specimen signature of the duly authorized signatory who are authorized to vote, at least 48

hours before the meeting to the Company at secretarial@ghcltextiles.co.in, if voted from individual tab & not

The procedure for e-Voting on the day of the AGM is same as the instructions mentioned above for Remote e-voting.

The link for VC/OAVM to attend meeting will be available where the EVSN of Company will be displayed after

Shareholders who have voted through Remote e-Voting will be eligible to attend the meeting. However, they will not

Further shareholders will be required to allow Camera and use Internet with a good speed to avoid any disturbance

Please note that Participants Connecting from Mobile Devices or Tablets or through Laptop connecting via Mobile

Hotspot may experience Audio/Video loss due to Fluctuation in their respective network. It is therefore

speaker by sending their request in advance at least seven days prior to meeting mentioning their name, demat

account number/folio number, email id, mobile number at (company email id). The shareholders who do not wish to

speak during the AGM but have queries may send their queries in advance seven days prior to meeting mentioning

their name, demat account number/folio number, email id, mobile number at (secretarial@ghcltextiles.co.in). These

Those shareholders who have registered themselves as a speaker will only be allowed to express their views/ask

Only those Members/ Members, who will be present in the AGM through VC/OAVM facility and have not casted their

vote on the Resolutions through remote e-Voting and are otherwise not barred from doing so, shall be eligible to vote

If any Votes are cast by the members through the e-voting available during the AGM and if the same members have

not participated in the meeting through VC/OAVM facility, then the votes cast by such members shall be considered

Members who have voted through Remote e-Voting will be eligible to attend the AGM. However, they will not be

Member will be provided with a facility to attend the AGM through VC/OAVM through the CDSL e-voting system.

invalid as the facility of e-voting during the meeting is available only to the members participating in the meeting.

Custodian, if any, should be uploaded in PDF format in the system for the scrutinizer to verify the same

demat account or in the company records in order to logir

/ folio number in the Dividend Bank details field.

with any other person and take utmost care to keep your password confidential

Click on the EVSN for the relevant < Company Name > on which you choose to vote.

Click on the "RESOLUTIONS FILE LINK" if you wish to view the entire Resolution details.

(xiii) Once you "CONFIRM" your vote on the resolution, you will not be allowed to modify your vote.

code and click on Forgot Password & enter the details as prompted by the system.

www.evotingindia.com and register themselves in the "Corporates" module.

Compliance User would be able to link the account(s) for which they wish to vote on.

uploaded same in the CDSL e-voting system for the scrutinizer to verify the same.

The instructions for Members voting on the day of the AGM on e-voting system are as under:

Shareholders are encouraged to join the Meeting through Laptops / IPads for better experience.

recommended to use Stable Wi-Fi or LAN Connection to mitigate any kind of aforesaid glitches.

ss their views/ask que

successful login as per the instructions mentioned above for e-voting.

Note for Non - Individual Members and Custodians for remote voting only:

After entering these details appropriately, click on "SUBMIT" tab

option NO implies that you dissent to the Resolution

accordingly modify your vote.

helpdesk.evoting@cdslindia.com.

Shareholders who would like to expr

questions during the meeting.

eligible to vote at the AGM.

queries will be replied to by the company suitably by email.

Instructions for members for attending the AGM through VC / OAVM are as under:

through e-Voting system available in the AGM.

Enter your 10 digit alpha-numeric \*PAN issued by Income Tax Department (Applicable for demat

Members who have not updated their PAN with the Company/Depository Participant are requested

If both the details are not recorded with the depository or company, please enter the member id

Pradesh and Bihar, where ATM penetration is low, Srinivas said. Even post-Covid, despite a sharp surge in digital transactions, cash transactions continue to grow. 'Two-thirds of the country's consumption expenditure still happens in cash," he said.

In addition, the company is also looking at providing switching services to ATM networks of smaller banks that may not have inhouse capabilities for the purpose. The company has built its own switch to manage its network of 12,200 ATMs.

### **NETS ONLY 82.44% SUBSCRIPTIONS**

# **Brookfield's OFS in** Telecom InvIT Fails to Get Enough Bids

Canadian firm had units amounting to 7%, but subscriptions represented 6% stake

> Swaraj.Dhanjal @timesgroup.com

Mumbai: Canadian investment firm Brookfield's offer for sale (OFS) of units of its telecom tower InvIT Data Infrastructure Trust was subscribed only 82.44% on Wednesday, against a base offer size of ₹2.824 crore, showed data from BSE.

The infrastructure investment trust (InvIT) mainly comprises telecom towers with Reiance Jio as the anchor tenant. Against the 182.2 million units on offer, representing a 7% sta-

ke in the InvIT, the OFS received bids of 150.2 million shares. This means at the offer floor price of ₹155 per unit, Brookfield managed to sell units worth ₹2,331 crore, representing around 6% stake.

Secondary share sales like OFS do not have a minimum subscription requirement. Interestingly, Brookfield had intended to sell a total of 10% stake in the InvIT through the

Apart from the base offer of 182.2 million shares of ₹2,824 crore. Brookfield announced that it had the option to sell another 78 million units, representing a 3% stake, in case of oversubscrip-

Together, Brookfield planned to sell units worth ₹4,033 crore. BIF IV Jarvis India, a Brookfield entity and the sponsor of the InvIT, currently holds around 88% stake in the trust. It needs to bring down its shareholding to 75% to meet the minimum public shareholding norms mandated

"They need to bring down their shareholding to 75% soon. So they are planning to tap the market again with another OFS before the end of the gap of two weeks between con- sale.

secutive OFS deals," said a source aware of the developments speaking on the condition of anonymity.

"There is more demand from the same anchor investors in this deal to pick up more stake, but OFS

The InviT called Data Infrastructure Trust mainly comprises urce said. telecom towers with

the anchor Columbia Investment (BCI) was coming in as the anchor investor

for the deal. "BCI bid for InvIT units worth

the condition of anonymity.

response till press time. Investment bank Axis Capital

Whatever stake is left after the second OFS is likely to be sold off thereafter through a block deal, he added.

norms don't allow a single investor to subscribe to more than 25% of the offer. The same anchor investors will come in the next tranche of OFS too.

This was the first OFS by an InvIT, so garnering demand of ₹2.300 crore is a good outcome," the so-Earlier on Wednesday, ET repor-Reliance Jio as

ted that Canadian pension fund manager British

\$120 million (approximately ₹994.24 crore). Other bidders included domestic institutional investors and corporate treasuries. There was also surprisingly strong interest from high networth individuals," said a second person, also speaking on

This will mark BCI's second in vestment in an infrastructure investment trust in India this year. Brookfield declined to comment. An email sent to BCI did not elicit a

month. Sebi rules mandate a advised Brookfield on the share

# **GHCL Textiles Limited**

Details OR

Date of Birth

Regd. Off.: GHCL House, Opp. Punjabi Hall, Navrangpura, Ahmedabad-380009 (Gujarat). Phone: 079-26434100, Fax: 079-26423623 Email: info@ghcltextiles.co.in, secretarial@ghctextiles.co.in; Website: www.ghctextiles.co.in (CIN: U18101GJ2020PLC114004)

### NOTICE OF 3RD ANNUAL GENERAL MEETING, REMOTE E-VOTING INFORMATION AND CUT-OFF DATE

NOTICE is hereby given that 3rd Annual General Meeting (AGM) of the Company will be held on Thursday, September 21, 2023 (गुरुवार, भाद्रपद शुक्ल पक्ष - सप्तमी, विक्रम संवत २०८०) at 02.30 P.M. (IST) through Video Conferencing (VC) or Other Audio Visual Means (OAVM), as per the framework issued by the Ministry of Corporate Affairs (MCA) vide General Circular No. 14 of 2020 dated April 08, 2020, Circular No. 17 of 2020 dated April 13, 2020, Circular No. 20 of 2020 dated May 05, 2020, and General Circular No. 10/2022 dated December 28, 2022 and SEBI Circular dated 12th May, 2020, and January 5, 2023 (collectively referred to as "Circulars")

In compliance with the above circulars read with SEBI Circular dated May 13, 2022 and SEBI Listing Regulations, 2015, Notice of 3rd AGM and financial statements (including Board's report, Auditor's report or other documents required to be attached therewith) for FY 2022-23 (collectively referred as "Annual Report"), will be sent only through email to all members (as per the Benepose Report dated August 18, 2023), on their registered email id and no physical copy of the same would be dispatched. However, physical copy of the Annual Report will be sent on demand. Annual Report shall be available on the website of BSE Limited (www.bseindia.com) and National Stock Exchange of India Limited (www.nseindia.com) where the Company's shares are listed and shall also be available on the website of the Company (www.ghcltextiles.co.in).

Please note that Company is convening 3rd AGM through VC / OAVM and no physical presence of members, directors, auditors and other eligible persons shall be required for this AGM. As per MCA circulars, the facility to appoint proxy to attend and cast vote for the members is not available for this 3rd AGM. However, the Body Corporates are entitled to appoint authorised representatives to attend the 3rd AGM through VC/OAVM and participate thereat and cast their votes through e-voting. Members, directors, auditors and other eligible persons to whom this notice is being circulated can attend this AGM through video conferencing at least 15 minutes before the schedule time. The attendance of the Members attending the AGM through VC/OAVM will be counted for the purpose of reckoning the quorum under Section 103 of the

In order to send Annual Report and other communication to shareholders in electronic form, we request the members of GHCL Textiles Limited (the Company), who have not yet registered their email and mobile number, to register the same immediately in respect of shares held in electronic form with their Depository Participant.

The members are hereby informed that pursuant to provisions of Section 108 of the Companies Act, 2013 read with Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014, as amended and Regulation 44 of the SEBI (Listing Obligations & Disclosure Requirements) Regulations, 2015, the Company is providing its members facilities for e-Voting Services provided by Central Depository Services (India) Limited (CDSL) in respect of the following businesses:

### Ordinary Business:

- 1. Adoption of audited standalone financial statements of the Company for the financial year ended March 31, 2023, and the reports of the Board of Directors and auditors thereon along with other necessary reports.
- 2. Re-appointment of Mr. Raman Chopra as a Director of the Company, liable to retire by rotation.

- 3. Approval for appointment of Dr. Manoj Vaish (DIN: 00157082), as an Independent Director of the Company.
- Approval for appointment of Mrs. Vijaylaxmi Joshi, Ex-IAS (DIN: 00032055), as an Independent Director of
- 5. Approval for appointment of Mr. Arun Kumar Jain, Ex-IRS (DIN: 07563704), as an Independent Director of
- 6. Approval of remuneration payable to Non-Executive Directors by way of Commission
- 7. Ratification of remuneration of Cost Auditors.

During the remote e-voting period, members of the Company, holding shares as on the cut-off date i.e. Thursday, September 14, 2023, may cast their vote electronically. The remote e-voting period commences at 9:00 a.m. (IST) on Monday, September 18, 2023 and ends at 5:00 p.m. (IST) on Wednesday, September 20, 2023. The e-voting module shall be disabled by CDSL for voting thereafter. Once a vote on resolution is cast, the member shall not be allowed to change it subsequently. The facility for voting, through electronic voting system, shall also be made available during the meeting and members attending the meeting who have not already cast their vote by remote e-voting shall be able to exercise their right at the meeting. The members who have cast their vote by remote e-voting prior to the meeting may also attend the meeting but shall not be entitled to cast their vote again.

### Instructions for members for remote e-voting are as under:

### Step 1: Access through Depositories CDSL/NSDL e-Voting system in case of individual shareholders holding shares in demat mode

(I) Pursuant to SEBI Circular no. SEBI/HO/CFD/CMD/CIR/P/2020/242 dated December 9, 2020 on e-Voting facility provided by Listed Companies, Individual Members holding securities in demat mode are allowed to vote through their demat account maintained with Depositories and Depository Participants. Members are advised to update their mobile number and email Id in their demat accounts in order to access e-Voting facility.

In order to increase the efficiency of the voting process, all the Demat account holders, by way of a single login credential, through their Demat accounts/ websites of Depositories/ Depository Participants, able to cast their vote again with the e-voting service providers (ESPs), the authentication but also enhancing ease and convenience of participating in e-voting process.

Pursuant to said SEBI Circular, login method for e-Voting and joining virtual meetings for Individual Members holding securities in Demat mode (NSDL/CDSL) is given below:

Login Method

Members	Login Method
Individual Members holding securities in	<ol> <li>Users who have opted for CDSL Easi / Easiest facility, can login through their existing user id and password. Option will be made available to reach e-Voting page without any further authentication. The users to login to Easi / Easiest are requested to visit CDSL website <a href="https://www.cdslindia.com">www.cdslindia.com</a> and click on login icon &amp; New System Myeasi Tab.</li> </ol>
Demat mode with CDSL	2) After successful login the Easi / Easiest user will be able to see the e-Voting option for eligible companies where the evoting is in progress as per the information provided by company. On clicking the evoting option, the user will be able to see e-Voting page of the e-Voting service provider for casting your vote during the remote e-Voting period or joining virtual meeting & voting during the meeting. Additionally, there is also links provided to access the system of all e-Voting Service Providers, so that the user can visit the e-Voting service providers' website directly.
	If the user is not registered for Easi / Easiest, option to register is available at CDSL website www.cdslindia.com and click on login & New System Myeasi Tab and then click on registration option.
	4) Alternatively, the user can directly access e-Voting page by providing Demat Account Number and PAN No. from a link in <a href="www.cdslindia.com">www.cdslindia.com</a> home page. The system will authenticate the user by sending OTP on registered Mobile & Email as recorded in the Demat Account. After successful authentication, user will be able to see the e-Voting option where the e-voting is in progress and also able to directly access the system of all e-Voting Service Providers.
ndividual Members holding securities in demat mode with NSDL	If you are already registered for NSDL IDeAS facility, please visit the e-Services website of NSDL. Open web browser by typing the following URL: <a href="https://eservices.nsdl.com">https://eservices.nsdl.com</a> either on a Personal Computer or on a mobile. Once the home page of e-Services is launched, click on the "Beneficial Owner" icon under "Login" which is available under "IDeAS' section. A new screen will open. You will have to enter your User ID and Password. After successful authentication, you will be able to see e-Voting services. Click on "Access to e-Voting" under e-Voting services and you will be able to see e-Voting page. Click on company name or e-Voting service provider name and you will be re-directed to e-Voting service provider website for casting your vote during the remote e-Voting period or joining virtual meeting & voting during the meeting.
	<ol> <li>If the user is not registered for IDeAS e-Services, option to register is available at <a href="https://eservices.nsdl.com">https://eservices.nsdl.com</a>. Select "Register Online for IDeAS "Portal or click at <a href="https://eservices.nsdl.com/SecureWeb/IdeasDirectReg.jsp">https://eservices.nsdl.com/SecureWeb/IdeasDirectReg.jsp</a></li> </ol>
	3) Visit the e-Voting website of NSDL. Open web browser by typing the following URL: <a href="https://www.evoting.nsdl.com/">https://www.evoting.nsdl.com/</a> either on a Personal Computer or on a mobile. Once the home page of e-Voting system is launched, click on the icon "Login" which is available under 'Shareholder/Member' section. A new screen will open. You will have to enter your User ID (i.e. your sixteen digit demat account number hold with NSDL), Password/OTP and a Verification Code as shown on the screen. After successful authentication, you will be redirected to NSDL Depository site wherein you can see e-Voting page. Click on company name or e-Voting service provider name and you will be redirected to e-Voting service provider website for casting your vote during the remote e-Voting period or joining virtual meeting & voting during the meeting
ndividual Members holding securities in demat mode) ogin through heir Depository Participants	You can also login using the login credentials of your demat account through your Depository Participant registered with NSDL/CDSL for e-Voting facility. After Successful login, you will be able to see e-Voting option. Once you click on e-Voting option, you will be redirected to NSDL/CDSL Depository site after successful authentication, wherein you can see e-Voting feature. Click on company name or e-Voting service provider name and you will be redirected to e-Voting service provider website for casting your vote during the remote e-Voting period or joining virtual meeting & voting during the meeting.

(II) Members who are unable to retrieve User ID/Password are advised to use Forget User ID and Forget Password option

### Step 2:Access through CDSL e-Voting system in case of non-individual shareholders in demat mode.

- Login method of e-Voting for Members (including HUF) other than individual Members. Log on to the e-voting website www.evotingindia.com
- Click on "Members" tab Now Enter your User ID
- a. For CDSL: 16 digits beneficiary ID,
- b. For NSDL: 8 Character DP ID followed by 8 Digits Client ID.
- Next enter the Image Verification as displayed and Click on Login.
- If you are holding shares in Demat form and had logged on to www.evotingindia.com and voted on an earlier voting
- of any company, then your existing password is to be used. If you are a first time user follow the steps given below:

Place: Noida Date: August 10, 2023

Members may access the same at https://www.evotingindia.com under Members / members login by using the remote e-voting credentials. The link for VC/OAVM will be available in shareholder/members login where the EVSN of Company will be displayed Members are encouraged to join the Meeting through Laptops/Personal Computers for better experience. Further, Members will be required to allow Camera and use Internet with a good speed to avoid any disturbance

Please note that Participants connecting from Mobile Devices or Tablets or through Laptop connecting via Mobile

Hotspot may experience Audio/Video loss due to Fluctuation in their respective network It is therefore recommended to use Stable Wi-Fi or LAN Connection to mitigate any kind of aforesaid glitches.

Members who would like to express their views/ask questions during the Meeting may register themselves as a speaker by sending their request 7 days prior to Meeting mentioning their name, demat account number/folio number, email id, mobile number at secretarial@ghcltextiles.co.in and register themselves as speaker. Only those who have registered themselves as a speaker will be allowed to express their views/ask questions during the meeting.

Company is providing two way teleconferencing facility or WebEx for the ease of participation of the members. Recorded transcript of the meeting shall be uploaded on the website of the Company and the same shall also be ained in safe custody of the Company

### For Assistance / Queries for e-voting etc.

in Demat mode

Login type	Helpdesk details
Individual Members holding securities in Demat mode with CDSL	<ul> <li>(a) If you have any queries or issues regarding attending e-voting from the e-voting system, you may refer the Frequently Asked Questions ("FAQs") and e-voting manual available at <a href="https://www.evotingindia.com">www.evotingindia.com</a> under help section or write an email to <a href="https://exoting@cdslindia.com">help section or write an email to <a href="https://exoting.gedslindia.com">help section or write an email to <a href="https://exoting.gedslindia.com">help desk.evoting@cdslindia.com</a> and sections was addressed to <a href="https://exoting.gedslindia.com">Mr. Rakesh Dalvi, Sr. Manager, (CDSL)</a> Central Depository Services (India) Limited, A Wing, 25th Floor, Marathon Futurex, Mafatlal Mill Compounds, N M Joshi Marg, Lower Parel (East), Mumbai - 400013 or send an email to <a href="https://exoting.gedslindia.com">help section or contact at toll free no.1800225533</a>.</a></a></li> </ul>
Individual Members holding securities	Members facing any technical issue in login can contact NSDL helpdesk by sending a request at <a href="mailto:evoting@nsdl.co.in">evoting@nsdl.co.in</a> or call at toll free no.: 1800 1020 990 and 1800 22 44 30.

with NSDL Members holding shares in electronic form may update such relevant details(address, bank details, email etc.) with their respective Depository Participant.

Mr. Manoj R. Hurkat, Practicing Company Secretary holding Membership No. F4287 and Certificate of Practice No. 2574 has been appointed as the Scrutinizer to scrutinize the voting and remote e-voting process in a fair and transparent manner. The Board has also authorised KMP to appoint one or more scrutinizers in addition to and/or in place of Mr. Hurkat. The Scrutinizer shall, immediately after the conclusion of voting at the general meeting, first count the votes cast at the meeting, thereafter unblock the votes cast through remote e-voting in the presence of at least two witnesses not in employment of the Company and make, not later than two working days from the conclusion of meeting, a consolidated scrutiniser's report of the total votes cast in favour or against, if any to the Chairman of the Meeting or a person authorised by him in writing who shall countersign the same. Thereafter, the Chairman of the Meeting or the person authorised by him in writing shall declare the result of the voting forthwith.

The Results declared along with the Scrutinizer's Report shall be placed on the Company's website www.ghcltextiles.co.in and on the website of CDSL immediately after the result is declared by the Chairman of the Meeting; and results shall also be communicated to the Stock Exchanges. Members are requested to send their queries, if any, at least seven days in advance of the meeting so that the information

For GHCL Textiles Limited Lalit Narayan Dwivedi Company Secretary Membership No. F10487

# **Bond Yields in Narrow** Range to Limit Banks' **Treasury Gains**

Saloni Shukla @timesgroup.com

dian lenders are likely to moderate in the coming quarters as bond vields remain in a narrow range. with the Reserve Bank of India (RBI) possibly sticking to a long pause. Banks will also see pressure on earnings growth with a likely increase in provisions for expected credit loss, a new accounting norm that is kicking in.

For the first quarter, the State July. Bank of India reported a treasury income of ₹3,850 crore, the highest in the past 12 quarters. Likewise for Axis Bank, the whole business income was soft, but a treasury gain of ₹519 crore aided the return on assets (ROA) ratio.

Analysts believe such gains will be hard to come by in the fu-

"ROAs have clearly peaked and we should see a steady decline over the next few quarters from current levels. This quarter also has the support of treasury gains which won't recur," said Suresh Ganapathy, associate director at Macquarie Capital. "Issue is bulk of deposit rate hikes happened post September last year and assuming 12 to 18 months reyet to happen and I am not congo up and offset deposit cost increase. So we are in for some negative surprises on margins."

Analysts are also saying that tings said in a report.

banks could see pressures on provisioning as well as most state-run lenders don't hold any excess provisions. According to Mumbai: Treasury gains for In- Ganapathy, the expected credit loss accounting norms could add a cost of 100 to 200 basis points to bank balance sheets.

> om banks will have to raise rates as RBI is expected to go for a loan pause to rein in inflation. Experts say that while inflation was lower than 5% in June, it's expected to come closer to 6% in "The RBI has no compelling reason to spur growth presently

Another issue is the limited ro-

and hence reporate will remain unchanged till the end of the calendar year," said Madan Sabnavis, chief economist at the Bank of Baroda. 'Fed has indicated possible hi-

kes in future, and treasury yields have moved up. With comfortable liquidity, the stance of withdrawal of accommodation will remain.

In June 2023, fresh lending rates dropped while fresh deposit rates increased. The weighted average lending rate on fresh rupee loans of scheduled commercial banks declined sequentially by 7.5 basis points to 9.19% in June from 9.27% in May

"The withdrawal of ₹2,000 bankpricing period, full repricing is notes have boosted short-term liquidity in the banking sector thevinced that MCLRs can further reby reducing the pressure on deposit rates and in the later part of FY24, banks are likely to face pressure on NIMs," CARE Ra-

### **Sebi Halves Listing Timeline Post IPO Closure**

### **Press Trust of India**

New Delhi: Capital markets regulator Sebi on Wednesday halved the timeline for listing of shares on stock exchanges after the closure of Initial Public Offerings (IPOs) to three days from six days at present. The new listing timeframe will be voluntary for all public issues opening on or after September 1 and mandatory for all the issues which come after December 1, the Securities and Exchange Board of India (Sebi) said in a circular.

The reduction in timelines for listing and trading of shares will benefit both issuers and investors.

Issuers will have faster access to the capital raised thereby enhancing the ease of doing business and the investors will have the opportunity for having early credit and liquidity for their investment. "It has been decided to reduce the time taken for listing of specifi-

ed securities after the closure of public issue to three working days (T+3 days) as against the present requirement of six working days T+6 days). 'T' being issue closing date," Sebi said.

The regulator said that the compensation to investors for the delay in unblocking of ASBA application money shall be computed

# છેક્ષા બે વર્ષમાં વ્યાજદરમાં ૨૫૦ બેઝીક પોઈન્ટ જેટલો વધારો કર્યા બાદ આરબીઆઈને જ્ઞાન આવ્યુ

રિઝર્વ બેંક દ્વારા વ્યાજદરોમાં બહાર પાડી છે અને તેનો અમલ કરાતા ફેરફાર બાદ બેંકો ખાસ કરીને કરવો તમામ બેંકોએ ફરજીયાત થશે.

## રિઝર્વ બેંકે મુશ્કેલીમાં મુકાયેલા લાખો લોનધારકોને રાહત આપી

પ્લોટીંગ રેટ પર જે હોમલોન આપે આજે આરબીઆઈના ગવર્નર

છે તેના વ્યાજદરમાં તાત્કાલીક ફેરફાર શક્તિકાંતા દાસે જણાવ્યું હતું કે કરે છે અને તેના કારણે લોનધારકની પ્લોટીંગ રેટમાં પારદર્શકતા જરૂરી મુશ્કેલી વધતી હોવાથી રિઝર્વ બેંકે છે. બેંકોએ હવે આ માટે પ્લોટીંગ

પેમેન્ટની પણ

સુવિધા અપાઈ છે.

જેમાં પેમેન્ટ પુર્વે

શકાશે. આ માટે એ.આઈ.પાવર

સીસ્ટમનો ઉપયોગ થશે. આ ઉપરાંત

તેમાં નીયર ફિલ્ડ કોમ્યુનીકેશનની

સુવિધાનો ઉપયોગ કરી શકશે તથા ખાસ

ઓફલાઈન ટેકનોલોજીનો પણ ઉપયોગ

મારૂ નામ સૂર્યકાંત હતું તે

બદલીને હવે સૂર્યકાંત વર્મા

કરેલ છે. ૬, હિરણ્ય

એપાર્ટમેન્ટ, તુલીપ બંગલો

પાસે, સુરધારા સર્કલ, થલતેજ,

અમદાવાદ-૩૮૦૦૫૪

કરી શકશે.

# યુપીઆઇ લાઇટ મારફત હવે રા.૫૦૦ સુધીના

ડિઝીટલ વ્યવહારોને પ્રોત્સાહન પણ ડિઝીટલ વ્યવહારમાં સરળતા આપવા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ રહેશે. રિઝર્વ બેંકે યુપીઆઈ લાઈટ હવે યુપીઆઈ લાઈટ પેમેન્ટ સુવિધાને ભવિષ્યમાં વધુ વિસ્તૃત બનાવવાની પણ

વ્યવહારની મર્યાદા **આરબીઆઈ દ્વારા** તૈયારી કરી છે. રા.૨૦૦થી વધારી રા.૫૦૦ કરી છે. **રા.૨૦૦ની મર્યાદા** એક કન્ઝવેર્શન આરબીઆઈના વધારાઈ ગવર્નર શક્તિકાંતા

દાસે આજે આ માહિતી આપતા જણાવ્યું કે આજથી જ તેનો અમલ યુઝર્સ તે સંબંધી વાતચીત પણ કરી થઈ ગયો છે અને કુલ વ્યવહાર મર્યાદા રૂા.૨૦૦૦ની હશે. તેમણે જણાવ્યું કે નાની કિંમતના ડિઝીટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા આ નિર્ણય લેવાયો છે. અત્યાર સુધી રૂા.૨૦૦ સુધીના વ્યવહાર કોઈપણ 'પિન' વગર થઈ શકતા હતા. યુપીઆઈ લાઈટ એ મોબાઈલ વેલેટ એપ્લીકેશન છે. જેમાં હવે ઉપયોગ કરતા કોઈપણ સમયે વધુમાં વધુ રૂા.૨૦૦૦ના વ્યવહારો કરી શકશે જેમાં પ્રતિ વ્યવહાર રૂા.૨૦૦ની મર્યાદા હતી તે વધારીને રૂા.૫૦૦ની કરવામાં આવી

જાહેર નોટીસ પ્રમોદચંદ્ર કનૈયાલાલ પંડ્યા તથા નયનાબેન લેવી. પ્રમોદચંદ્ર પંડ્યાને વેચાણ આપેલ. ત્યારબાદ અમદાવાદ તેઓએ સદરહું મીલકત વેચાણ દસ્તાવેજ નં. તા. ૧૦-૦૮-૨૦૨૩ ૧૦૪૮૬ થી તા. ૦૮-૦૯-૨૦૧૧ ના રોજ નિરવ કે. હીરપરા (એકવોકેટ)

મીલકતના દસ્તાવેજોમાંથી વેચાણ દસ્તાવેજ આથી જાહેર જનતાને જણાવવામાં આવે છે કે નં.૩૫૭૧ થી તા.૧૮-૨-૧૯૯૨ ના રોજ રજીસ્ટ્રેશન સ્ટ્રિટ્રેક્ટ અમદાવાદ સબ-સ્ટ્રિટ્રેક્ટ નોંધાયેલ છે. જે અસલ દસ્તાવેજ હાલના અમદાવાદ-૧૦ (વેજલપુર) વેજલપુર માલિક પ્રજાપતિ ઉમેશભાઈ પુખરાજભાઈથી તાલુકાના મોજે ગામ વેજલપુરની સીમના ક્યાંક ગુમ થયેલ છે. અને ઘણી શોધ ખોળ રેવન્યુ સર્વે નં. ૪૭૧, ટી.પી. સ્ક્રીમ નં.૨, ફા. કરવા છતાં મળી આવેલ નથી. એ રીતે પ્લોટ નં. ૫૯ ની બીનખેતી જમીન ઉપર દોશી ઉપરોત મીલકત ઉપર ઉપર કોઈપણ શખ્સ કે પાર્ક કો.ઓ.હા.સો.લી. જે નવકાર સંસ્થાનો કોઈપણ પ્રકારનો લાગ-ભાગ, હક્ક, એપાર્ટમેન્ટના નામથી ઓળખાય છે. તેમાં હિત, દાવો, અલાખો યા લેણા, ખોરાકી, બ્લોક નં. ડી ના સેકન્ડ ક્લોર ઉપર આવેલ પોષાકી, બક્ષીસ વિગેરેનો બોજો હોય તો આ ક્લેટ નં.ડી-૧૦ જેનું ક્ષેત્રકળ આશરે ૯૦ નોટીસ પ્રસિધ્ધ થયે થી દિન. ૭ માં ચો.વાર યાને કે ૭૫.૨૫ સ.ચો.મી.ના ૨જી.એડીથી તે બાબતનાં લેખીત પુરાવા સહીત બાંધકામવાળી મીલકત, સોસાયટીએ સૌ અમોને નીચેના સરનામે જાણ કરાવી જો તેમ પ્રથમ કમલા રણજીતમલ નાઓએ શેરફાળો, કરવામાં નહી આવે તો ઉપરોક્ત મીલકતમાં જમીનફાળો ભરતા શેર સર્ટીફીકેટના આધારે કોઈનો કોઈપણ પ્રકારનો લાગ-ભાગ, હક્ક, એલોટ કરીને પઝેશન આપેલ. ત્યારબાદ હિત, હીસ્સો, દાવો, બોજો, અલાખો, ગીરો, તેઓએ સદરહું મીલકત વેચાણ દસ્તાવેજ બક્ષીસ, કે અન્ય કોઈ હક્ક નથી અને જો હોય નં.૩૫૭૧ થી તા.૧૮-૨-૧૯૯૨ ના રોજ તો તેવા તમામ હક્કો જે તે ઈસમોએ ડો. મહેન્દ્ર કાંતિલાલ ઠક્કર તથા ઉષાબેન મીલકતનાં માલીકોની તરફેણમાં જતા યાની મહેન્દ્રભાઈ ઠક્કરને વેચાણ આપેલ. ત્યારબાદ વેવ કરેલ છે. તેમ સમજવામાં ોઓએ સદરહું મીલકત વેચાણ દસ્તાવેજ આવશે.ત્યારબાદ કોઈની કોઈપણ પ્રકારની નં.૨૧૪૩ થી તા.૧૩-૮-૨૦૦૨ ના રોજ તકરાર ચાલશે નહી જેની જાહેર જનતાએ નોંધ

પ્રજાપતિ ઉમેશભાઈ પુખરાજભાઈ ને વેચાણ ઓફ્ટિસ : ૧૫૦, મારૂતિ પ્લાઝા, પ્રકાશ આપેલ. હાલ સદરહું મીલકતના પ્રજાપતિ હાઈસ્કુલની બાજુમાં, સૃષ્ણનગર, ઉમેશભાઈ યુખરાજભાઈ સ્વતંત્ર માલિક, અમદાવાદ . મો. ૯૦૩૩૫७७૮૮૦ કબજેદાર, ભોગવટેદાર છે. અને સદરહુ

### એક્સિસ બેંક લિમિટેડ પ્લેજ અસ્ક્યામતો તરીકે સોનાના દાગીનાના લિલામ - માટે જાહેર નોટિસ

દેશદારોને વિશેષ રૂપે અને જાહેર જનતાને આથી જણાવવામાં આવે છે કે નીચેના ખાતાઓમાં લેજ કરેલ સોનાના દાગીનાઓનું જાહેર લિલામ એક્સિસ બેંક દ્વારા નીચે જણાવેલ શાખામાં કરવાનો

નીચે ઉલ્લેખ કરેલ દેશદારોએ બેંકની તરફેશમાં સિક્યોરિટી તરીકે સોનાના દાગીના પ્લેજ કરીને (ગિરો) (સુવર્ણ ધિરાણ સુવિધા) શાખ સવલત મેળવી છે. દેણદારો/જામીનદારોને ડિમાન્ડ નોટિસો મોકલવામાં આવી હતી જેમાં દેશદારો/જામીનદારોને તેમની સુવર્શ ધિરાણ સુવિધા તરીકે મેળવેલ બાકી નીકળતી રકમ ચકવી જવા માટે જણાવેલ. દેણદારો/જામીનદારો ધિરાણની આ બાકી રકમની પરત ચકવણી કરવામાં નિષ્ફળ ગયા છે, આથી બેંક નાછુટકે ગિરો રાખેલ ચીજો માટે વિનંતી કરવી પડેલ છે અને ગિરો રાખેલ સોનાના દાગીનાનું લિલામથી વેચાણ -ખાસ તો અહીં મિલકતની સુચીમાં વર્ણન કરેલી- તા. ર ૧મી ઑગસ્ટ, ૨૦૨૩ના રોજ બપોરે ૧૨.૩૦ થી બપોરે ૦૩.૩૦ દરમિયાન<sup>ે</sup> "જેમ છે, જયાં છે", "જે છે તે છે", "જે કાંઈ છે તે છે" અને "કોઈના આશ્રય વિના" કરવા માટે પ્રસ્તાવ મૂકેલ છે.

દેણદારો અને બાકી રકમની વિગત :

ગ્રાહકનું નામ	ધિરાણ	બાકી રકમ	રિકોલ નોટિસની	ગ્રોસ વજન	નેટ	
	ખાતા નંબર	(રૂ.)	તારીખ		વજન	
શાખાનું નામઃ અમદાવાદ (ગુજ)						
પંચાલ નયનાબેન	xxxxxxxxxx3249	૧૨૧૫૫૪.૨૬	૧૨-ઓક્ટો-	3€.900	૩૫.૬૦૦	
તરુણભાઈ			૨૨			
	શાખાનું નામ	ાઃ ઇડર(ગુજ)				
કનકસિંહ સમરસિંહ	XXXXXXXXXXXZC09	૧૭૫૪૨૮.૦૦	૩૦-મે-૨૩	૫૩.૧૦૦	૫૧.૬૦૦	
રાઠોડ						
પરમાર રાકેશકુમાર	XXXXXXXXXXXX929	૯૨૭૧૩.૦૦	૩૦-મે-૨૩	२६.८००	२€.300	
સોમભાઈ	<u> </u>		L			
	શાખાનું નામઃ	મણિનગર(ગુજ				
રંગરેજ મોહંમદમોહસીન ઉસ્માનગની	XXXXXXXXXXXE3Z2	५३४०६.४७	૨૭-જૂન-૨૩	१८.६००	96.300	
	શાખાનું નામ	: નરોડા(ગુજ)				
ભરતસિંહ ભગવતસિંહ	XXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXX	૫૮૧૨૬૧.૫૯	૧૮-જુલાઈ-	૧૯૨.૩૦૦	130,800	
ચુડાસમા			૨૩			
		પાલનપુર(ગુજ	,			
દશરથભાઈ ધનાભાઈ હાથેચિયા	xxxxxxxxx1919	४२३७२३.००	૨૭-જૂન-૨૩	131.600	12.300	
શાખાનું નામઃ રાધનપુર(ગુજ)						
રશ્મિકાબેન વિજયકુમાર	XXXXXXXXXXXC9Z3	૪૨૮૭૫.૦૦	૦૮-માર્ચ-૨૩	19.900	18.000	
6553						
		: વડસર(ગુજ)				
સુમિતકુમાર ઠાકોરભાઈ પટેલ	XXXXXXXXXXXCZC74	૧૩૫૭૫૬.૯૫	૨૭-જૂન-૨૩	૩૫.૩૬૦	38.850	
શાખાનું નામઃ વિરમગામ(ગુજ)						
દવે ઋષિકકુમાર રમણિકલાલ	XXXXXXXXX913Y	૭૫૨૬૬.૦૦	૩૦-મે-૨૩	૨૧.૩૦૦	૨૧.૦૦૦	
શાખાનું નામઃ વિસનગર(ગુજ)						
ચૌધરી ડાહ્યાભાઈ	XXXXXXXXXX3C92	પર૯૧૪.૦૦	૩૦-મે-૨૩	१४.६००	૧૪.૬૦૦	
એક્સિસ બેંક લિ.ને કોઈ આગળ નોટિસ આપ્યા વગર ખાત દર કરવાની/ હરાજીની તારીખમાં ફેરફાર કરવાની						

https://gold.samil.in પરથી બપોરે ૧૨.૩૦ થી બપોરે ૦૩.૩૦ વચ્ચે યોજાશે વિગતવાર નિયમો અને શરતો માટે, મહેરબાની કરીને આપેલ વેબસાઇટ https://gold.samil.ir

સત્તા છે.હરાજી ઓનલાઇન

અધિકૃત અધિકારી - એક્સિસ બેંક લિ. સ્થળઃ ગુજરાત

ફેરફાર સમયે જે તે ધિરાણ લેનારને જાણ કરવી કરજીયાત થઈ પડશે અને તેના ઈએમઆઈ (માસીક

અને જો લોનધારક ઈચ્છે તો તેને છ્ટ આપવાની રહેશે. કીકસ વ્યાજદરમાં પણ બદલવાની સુવિધા આપવી પડશે અથવા તો આ પ્રકારના કોઈપણ ફેરફાર કરે તે હપ્તા)માં કોઈપણ ફેરફાર કરે તો તે તેને કોઈ પેનલ્ટી વગર જ તેનું પૂર્વે લોનધારકને જાણ કરવી જરૂરી

આરબીઆઈએ જણાવ્યું છે કે બેંક

કરવાનો પણ વિકલ્પ આપવો પડશે.

બે વર્ષમાં વ્યાજદરમાં સતત વધારો રકમ વધી ગઈ છે અને લોનના હપ્તા લીધો છે.

આવકની સાનુકુળતા મુજબ ફેરફાર પોઈન્ટ વ્યાજ વધાર્યુ છે જેના કારણે પડે તે સ્થિતિ છતા અનેક લોનધારકો હાઉસીંગ લોન સહિતના મુશ્કેલીમાં મુકાયા હતા તે સંદર્ભમાં આરબીઆઈ દ્વારા હાલમાં છેલા લોનધારકોને તેના માસીક હપ્તાની હવે આરબીઆઈએ આ નિર્ણય

# જીએચસીએલ ટેક્ષટાઈલ્સ લિમીટેડ

૨જી. ઓફીસ ઃ જીએચસીએલ હાઉસ, પંજાબી હોલ સામે, નવરંગપુરા, અમદાવાદ–૩૮૦૦૦૯. (ગુજરાત). Ph. 079-39324100 Fax : 079-26423623 Email: info@ghcltextiles.co.in, secretarial@ghctextiles.co.in; Website: www.ghctextiles.co.in (CIN: U18101GJ2020PLC114004)

### **૩જી વાર્ષિક સાધારણ સભા, રીમોટ ઈ-વો**દિંગની માહિતી અને કટ-ઓફ તારીખ અંગેની નોટીસ

આથી અત્રે નોટીસ આપવામાં આવે છે કે કોર્પોરેટ કાર્ચ મંત્રાલય (એમસીએ) દ્વારા તા. ૦૮.૦૪.૨૦૨૦ ના રોજ જારી કરવામાં આવેલ સામાન્ય પરિપત્ર નં. ૧૪/૨૦૨૦, તા. ૧૩.૦૪.૨૦૨૦ ના રોજ જારી કરવામાં આવેલ પરિપત્ર નં. ૧७/૨૦૨૦, તા. ૦૫.૦૫.૨૦૨૦ ના રોજ જારી કરવામાં આવેલ પરિપત્ર નં. ૨૦/૨૦૨૦ અને તા. ૨૮.૧૨.૨૦૨૨ ના રોજ જારી કરવામાં આવેલ સામાન્ય પરિપત્ર નં. ૧૦/૨૦૨૨ તેમજ તા. ૧૨.૦૫.૨૦૨૦ અને ૦૫.૦૧.૨૦૨૩ ના રોજ સેબી દ્વારા જારી કરવામાં આવેલ પરિપત્ર (હવેથી તેને સંયુક્ત રીતે પરિપત્રો તરીકે ઓળખીશું) માં દર્શાવેલ માળખા અનુસાર કંપનીની રજી વાર્ષિક સાધારણ સભા (એજીએમ) વિડીયો કોન્ફરન્સીંગ (વીસી) અથવા અન્ય ઓડીયો વિઝ્યુઅલ સાધન (ઓએવીએમ) દ્વારા ગુરૂવાર, સપ્ટેમ્બર ૨૧, ૨૦૨૩ (ગુરૂવાર, ભાદ્રપક્ષ શુક્લપક્ષ – સપ્તમી, વિક્રમ સંવત ૨૦૮૦) ના રોજ બપોરના ૨:૩૦ કલાકે (ભારતીય સમય પ્રમાણે) રાખવામાં આવેલ છે.

ઉપરોક્ત બધા જ પરિપત્રો સાથે તા. ૧૩.૦૫.૨૦૨૨ ના રોજ ના સેબી દ્વારા જારી કરવામાં આવેલ પરિપત્રને વાંચતા તેમજ સેબી ધારો ૨૦૧૫ (નોંધણી કરાર અને સ્પષ્ટતાની જરૂરીયાત) મુજબ કંપનીની રજી વાર્ષિક સભાની નોટીસ અને નાણાંકીય અદેવાલો (જેમાં સામેલ છે બોર્ડનો અદેવાલ, ઓડીટરોનો અદેવાલ અને તેને સંલગ્ન અન્ય જરૂરી દસ્તાવેજો સહિત) નાણાંકીય વર્ષ ૨૦૨૨–૨૩ (જેને સંયુક્ત રીતે વાર્ષિક અદેવાલ કહેવાથ છે) ને ફક્ત ઈ–મેઈલ દ્વારા તેમના બધાજ સભાસદોને (તા. ૧૮.૦૮.૨૦૨૩ ના બેનેપોઝ રીપોર્ટ મુજબ) તેમના રજીસ્ટર્ડ ઈ–મેઈલ આઈડી ઉંપર મોકલવો અને તેની કોઈપણ ભૌતિક કોપી મોકલવામાં આવશે નહીં. તેમછતાં જો માંગણી કરવામાં આવશે તો નાણાંકીચ અફેવાલોની ભૌતિક કોપી મોકલવામાં આવશે. આ વાર્ષિક અફેવાલ કંપનીના શેરો નોંધાચેલ છે તે બીએસઈ લિમિટેડ (www.bseindia.com) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ (www.nseindia.com) ની વેબસાઈટ ઉપર ઉપલબ્ધ છે. અને કંપનીની વેબસાઈટ (<u>www.ghcltextiles.co.in</u>) ઉપર પણ ઉપલબ્ધ છે.

એની ખાસ નોંધ લેવી કે કંપનીની 3જી વાર્ષિક સભા વીસી / ઓએવીએમ દ્વારા યોજાતી હોવાથી અને તેથી કોઈપણ સભાસદ, કાયરેક્ટર્સ, ઓડીટર્સ અને અન્ય લાયક સભ્યએ એજીએમ માં પ્રત્યક્ષ હાજર રહેવાની જરૂર નથી. એમસીએ પરિપત્ર અનુસાર ૩જી એજીએમ માં પ્રોક્ષીની નિમણુંક કરી હાજર રહીને વોટ આપવાની સુવિધા ઉપલબ્ધ રહેશે નહીં. છતાંપણ બોડી કોર્પોરેટને તેના અધિકૃત વ્યક્તિની નિમણુંક કરીને વીસી / ઓએવીએમ દ્વારા યોજાતી ૩જી એજીએમ માં હાજર રહી ભાગ લઈ શકશે અને ઈ-વોર્ટીંગ દ્વારા તેનો વોટ પણ આપી શકશે. સભાસદો, ડાયરેક્ટર્સ, ઓડીટર્સ અને અન્ય લાયક સભ્યો કે જેમને એજીએમનો પરિપત્ર મોકલેલ છે તે વિડીયો કોન્ફરન્સીંગ દ્વારા મિટિંગના નક્કી કરેલ સમયના ૧૫ મિનિટ પહેલા હાજર રહી શકે છે. કંપની કાયદા ૨૦૧૩ની કલમ ૧૦૩ હેઠળ વીસી / ઓએવીએમ દ્વારા યોજાતી એજીએમ માં હાજર રહેલા સભાસદોની હાજરીની સંખ્યા કોરમના ઉદ્દેશથી ગણવામાં આવશે.

વાર્ષિક અઠેવાલો તેમજ અન્ય દસ્તાવેજો શેરઘારકોને ઈલેક્ટ્રોનિક સ્વરૂપમાં મોકલવા જીએચસીએલ ટેક્ષટાઈલ્સ લિમિટેડ (કંપની) દ્વારા તેમના સભાસદોને વિનંતિ કે જે સભાસદોના ઈ–મેઈલ આઈડી અને મોબાઈલ નંબર દજુસુધી નોંધાયેલ નથી તેમને જેમના શેરો ડીપોઝીટરી પાસે ઈલેક્ટ્રોનિક સ્વરૂપમાં નોંધાચેલા છે તેમના ઈ–મેઈલ આઈડી અને મોબાઈલ નંબર નોંધાવવાના રહેશે.

સભાસદોને આથી જણાવવામાં આવે છે કે કંપની ધારો ૨૦૧૩ની કલમ ૧૦૮ની જોગવાઈને કંપનીઓના (વ્યવસ્થાપન અને વહીવટ) નિયમો-૨૦૧૪ ના સુધારેલા નિયમ-૨૦ સાથે વાંચતા અને સેબી દ્વારા ઉમેરાયેલા નિયમો-૨૦૧૫ ના નિયમ-૪૪ (લિસ્ટીંગ ઓબ્લીગેશન્સ એન્ડ કિસ્ક્લોઝર રીક્વારમેન્ટ્સ) ના અનુપાલનાર્થે કંપની તેના સભાસદોને સેન્ટ્રલ ડીપોઝીટરી સર્વિસીસ (ઇન્ડિયા) લિ. (સીડીએસએલ) દ્વારા પૂરી પાડવામાં આવેલી રીમોટ ઈ–વોર્ટીંગ સેવાઓની સુવિધા નીચેના કામકોજ માટે આપી રહી છે.

૧. કંપનીના માર્ચ ૩૧, ૨૦૨૩ ના રોજ પૂર્ણ થતા નાણાંકીય વર્ષના ઓડીટ થયેલ વર્ગીકૃત વાર્ષિક નાણાકીય નિવેદનો અને બોર્ડ ઓફ કાયરેક્ટર્સના નિવેદનો તેમજ ઓડીટર્સે દ્વારા જારી કરવામાં આવેલા અન્ય જરૂરી નિવેદનોને સ્વીકૃતિ આપવી.

ર. ક્રમાનુસાર નિવૃત્ત થતા શ્રી રમણ ચોપડા ની કંપનીના ડાયરેકટર તરીકે પુનઃનિયુક્તિ.

સભાસદોનો પ્રકાર

- 3. કો. મનોજ વૈશ (DIN : 00157082) ની કંપનીના સ્વતંત્ર કાથરેક્ટર તરીકે નિયુક્તિની મંજૂરી આપવી.
- ૪. શ્રીમતી વિજયલક્ષ્મી જોષી Ex-IAS (DIN: 00032055) ની કંપનીના સ્વતંત્ર કાયરેક્ટર તરીકે નિયુક્તિની મંજૂરી આપવી.
- પ. શ્રી અરૂણ કુમાર જૈન Ex-IRS (DIN : 07563704) ની કંપનીના સ્વતંત્ર ડાયરેક્ટર તરીકે નિયુક્તિની મંજૂરી આપવી. g. નોન-એક્ઝીક્યુટીવ ડાયરેકટરોને કમિશન તરીકે ચૂકવાતા મહેનતાણાને સ્વીકૃતિ આપવી.

ઈ-વોટીંગ દ્વારા મતદાન કરી દીધું હશે તેઓ સભામાં હાજર રહી શક્શે. પરંતુ ફરીથી તેઓનો મત આપી શક્શે નહીં.

**૭. કોસ્ટ ઓડીટરોના મહેનતાણાને સુધાર**વા.

રીમોટ ઈ–વોટીંગના સમયગાળા દરમ્યાન જે સભાસદો તેમના શેરોને કટ ઓફ તારીખ એટલે કે ગુરવાર, સપ્ટેમ્બર ૧૪, ૨૦૨૩ ના રોજ સુધીમાં ઘારણ કરેલ હોય તેઓ ઈલેક્ટ્રોનિકલી મત આપવાનો અધિકાર ધરાવે છે. રીમોટ ઈ-વોર્ટીંગ સોમવાર, સપ્ટેમ્બર ૧૮, ૨૦૨૩ (સવારના ૯:00 કલાકે ભારતીય સમય પ્રમાણે) થી શરૂ થશે અને બુધવાર, સપ્ટેમ્બર ૨૦, ૨૦૨૩ (સાંજના પઃ૦૦ કલાકે ભારતીય સમય પ્રમાણે) ના રોજ પૂરો થશે. આ સમયગાળા દરમ્યાન સભાસદો ઇલેક્ટ્રોનિકલી તેઓનો મત આપી શક્શે. ત્યારબાદ સીડીએસએલ દ્વારા ઈ–વોટીંગ વ્યવસ્થા નિષ્કીય કરી દેવામાં આવશે. રીઝોલ્યુશન અંગે એકવાર વોટ આપી દેવાચા પછી સભાસદને તે બદલવા દેવામાં નહીં આવે. જે સભાસદોએ રીમોટી ઈ-વોર્ટીગથી મતદાન કર્યુ નહી હોય, તેઓને સભા દરમ્યાન સભામાં ઉપસ્થિત રહીને મતદાન કરી શકશે. જે સભાસદોએ સભા પહેલા રીમોટ

<u>રીગોટ ઈ-વોર્ટીંગ કરવા માટે સભાસદોને જરૂરી માહિતી નીચે મુજબ છે :</u>

સ્ટેપ ૧ : <u>કિમેટ સ્વરૂપમાં શેરઘરાવતા વ્યક્તિગત સભાસદો માટે સીડીએસએલ / એનએસડીએલ ઈ-વોર્ટીંગ સિસ્ટમ દ્વારા ઉપયોગ</u> કરવાની બાબતે :

તા. ૦૯.૧૨.૨૦૨૦ ના રોજના સેબીના પરિપત્ર નં. SEBI/HO/CFD/CMD/CIR/P/2020/242 અનુસાર નોંધાયેલી કંપનીઓએ તેમના વ્યક્તિગત સભાસદો કે જેઓ તેમના શેર કિમેટ સ્વરૂપમાં ધારણ કરે છે અને તેઓ કિપોઝીટરીઝ અને કિપોઝીટરી પાર્ટીશીપન્ટ પાસે તેમનું કિમેટ એકાઉન્ટ મેઈન્ટેઈન કરે છે, તેમને ઈ-વોર્ટીંગ સુવિધા પૂરી પાડવાની રહેશે. સભાસદોને વિનંતિ કે તેમના કિમેટ એકાઉન્ટ દર્શવિલ મોબાઈલ નંબર અને ઈ-મેઈલ આઈડી અપડેટ રાખવા કે જેથી તેઓ ઈ-વોટીંગ સુવિદ્યા સરળતાથી મેળવી શકે.

દરેક કિમેટ ધારકો માટે વોટીંગ પ્રક્રીયાની સુવિધાઓને સરળ અને કાર્યક્ષમ બનાવવા માટે કિપોઝીટરીઝ અને કિપોઝીટરી પાર્ટીશીપન્ટની વેબસાઈટ દ્વારા તેમના કિમેટ ઘારકોને એંક સિંગલ લોગ-ઈન ક્રેકેન્શીયલ પૂરી પાકવામાં આવશે જેના દ્વારા તેમને ઈ-વોટીંગ સર્વિસ પ્રોવાઈકર (ઈએસપીસ) પાસે ફરીથી રજીસ્ટર કર્ચા વગર વોટ આપી શકે એટલું જ નહીં પરંતુ તે ઈ-વોર્ટીંગ પ્રક્રીયામાં સરળતાથી ભાગ લઈ તેને વધ સારી રીતે ઉપયોગ કરી શકે.

સેબી પરિપત્ર અનુસાર કિમેટ સ્વરૂપમાં (સીકીએસએલ / એનએસકીએલ) શેર ધરાવનાર વ્યક્તિગત શેર ધારકો માટે ઈ–વોર્ટીગમાં લોગ–ઈન કરવાની વર્ચ્યુઅલ સભામાં જોડાવા માટે પ્રધ્ધતિ નીચે મુજબ છે.

લોગ-ઈનની પધ્ધતિ

સીડીએસએલ પાસે કિમેટ	<ol> <li>જે યુઝરોએ સીડીએસએલની ઇઝી / ઇઝીએસ્ટ સુવિધા લીધેલ ક્ષેય તેઓ તેમના કાલના યુઝર આઇડી અને પાસવર્ડ દ્વારા લોગ-ઈન કરી શકશે. તેમના માટે કોઈપણ વધારાનું ઓથેન્ટીકેશન વગર ઈ-વોર્ટીંગ પેજ ઉપર</li> </ol>	
સ્વરૂપમાં શેર ઘરાવનાર વ્યક્તિગત સભાસદો	જવાનો વિકલ્પ ઉપલબ્ધ છે. ઈકી / ઈકીએસ્ટ ચુકરો માટે લોગ-ઈન કરવા માટે સીકીએસએલની વેબસાઈટ : www.cdslindia.com ઉપર જવું અને લોગ-ઈન આઈકોન ઉપર કલીક કરી ન્યુ સિસ્ટમ માયઈકી સીલેક્ટ કરવું.  ર. સફળતાથી લોગ-ઈન થથા બાદ ઈકી / ઈકીએસ્ટ થુકર લાયક કંપનીનું ઈ-વોર્ટીંગ મેનુ જોઈ શકશે કે જ્યાં કંપની દ્વારા પૂરી પડાયેલ માહિતી પ્રમાણેની ઈ-વોર્ટીંગ પ્રક્રીયા ચાલતી કશે. ઈ-વોર્ટીંગ મેનુ ઉપર કલીક કરીને યુક્ર ઈ-વોર્ટીંગ સર્વિસ પ્રોવાઈક્ટ દ્વારા બનાવેલ ઈ-વોર્ટીંગ પેજ જોઈ શકશો અને રીમોટ ઈ-વોર્ટીંગ સમયગાળા દરમ્યાન તમારો વોટ આપી શકશો અથવા વર્ચ્યુઅલ સભામાં જોડાઈ શકશો તેમજ સભા દરમ્યાન મત આપી શકશો. વધુમાં બધા જ ઈ-વોર્ટીંગ સર્વિસ પ્રોવાઈક્ટ દ્વારા સિસ્ટમનો ઉપયોગ કરવા માટે એક લિંક પણ પૂરી પાડવામાં આવશે જેનાથી યુક્રર ઈ-વોર્ટીંગ સર્વિસ પ્રોવાઈક્ટની વેબસાઈટનો સીઘો જ ઉપયોગ કરી શકશે.	
	3. અને જો યુઝર એ ઇઝી / ઇઝીએસ્ટ વિકલ્પ પર રજીસ્ટર ન કોચ તો તેમને રજીસ્ટર કરવા માટે સીકીએસએલની વેબસાઇટ : <u>www.cdslindia.com</u> અને લોગ-ઇન પર ક્લીક કરવું અને ન્યુ સિસ્ટમ માથ ઇઝી ટેબ પર જઈ રજીસ્ટ્રેશનનો વિકલ્પ પસંદ કરવો.	
	જ. અન્ય રીતે, યુઝર સીધા જ <u>www.cdslindia.com</u> ના ક્ષેમ પેજ ઉપર કિમેટ એકાઉન્ટ નંબર અને પાન નંબર લખી ઈ-વોર્ટીંગ પેજનો ઉપયોગ કરી શકશે. સિસ્ટમ યુઝર દ્વારા કિમેટ એકાઉન્ટમાં જણાવેલ રજીસ્ટર્ક મોબાઈલ અને ઈ-મેઈલ ઉપર ઓટીપી મોકલી ઓથોરાઈઝ કરશે. સફળતાથી ઓથોરાઈઝ કર્યા બાદ યુઝર ઈ-વોર્ટીંગ પ્રક્રીયા માટેનું ઈ-વોર્ટીંગ કરવાનું વિકલ્પ જોઈ શકશે અને બધા જ ઈ-વોર્ટીંગના સર્વિસ પ્રોવાઈકર્સની સિસ્ટમ્સમાં સીધા જ વોટ કરવા જઈ શકશે.	
એનએસડીએલ પાસે કિમેટ સ્વરૂપમાં શેર ઘરાવનાર વ્યક્તિગત સભાસદો	૧. જો આપ પહેલેથી જ એનએસડીએલ IDeAS સુવિદ્યામાં રજીસ્ટર્ડ હોય તો એનએસડીએલની ઈ-સર્વિસીસ વેબસાઇટની મુલાકાત લો. આપના કોમ્પ્યુટર અથવા મોબાઈલમાં URL: https://eservices.nsdl.com લખી વેબસાઇટની મુલાકાત લો. આપના કોમ્પ્યુટર અથવા મોબાઈલમાં URL: https://eservices.nsdl.com લખી વેબ બ્રાઉઝર ઓપન કરો. એકવાર ઈ-સર્વિસીસનું હોમ પેજ ખુલી જશે પછી આપ બેનીફીશીચર ઓનર આઇકોન ઉપર ક્લીક કરી IDeAS સેકશન હેઠળ લોગ-ઈન કરી શકશો. નવી ટેબ ખુલશે જેમાં આપ લોગ-ઈન આઇડી પાસવર્ડ નાખી શકશો. સફળતાપૂર્વક ઓઇન્ટીકેશન થયા બાદ આપ ઈ-વોર્ટીંગ સર્વિસીસ જોઈ શકશો. ઇ-વોર્ટીંગ સર્વિસ હેઠળ ''એક્સેસ ટુ ઈ-વોર્ટીંગ' ઉપર કલીક કરીને તમે ઈ-વોર્ટીંગ પેજ જોઈ શકશો. કંપની નામ અથવા ઈ-વોર્ટીંગ સર્વિસ પ્રોવાઈક્ટરની વેબસાઈટ ઉપર લઈ જશે જયાં આપ આપનો વોટ રીમોટ ઈ-વોર્ટીંગ દરમ્યાન અથવા વચ્ચુંઅલ સભામાં જોડાઈ અને સભા દરમ્યાન વોટ આપી શકશો.	

ર. જો આપ IDeAS ઈ-સર્વિસીસમાં રજીસ્ટર્ડ ન હોવ તો આપના માટે https://eservices.nsdl.com રજીસ્ટર્ડ થવા માટેનો વિકલ્પ ઉપલબ્ધ છે. IDeAS પોર્ટલ ઉપર ઓનલાઈન રજીસ્ટર કરો અથવા ક્લીક કરો https://eservices.nsdl.com/SecureWeb/IdeasDirectReg.jsp 3. એનએસડીએલની ઈ-વોર્ટીંગની વેબસાઈટની મુલાકાત લો. આપના કોમ્પ્યુટર અથવા મોબાઈલમાં URL: https://www.evoting.nsdl.com/ લખી ઈ–વોર્ટીંગ સિસ્ટમનું હોમ પેજ ખુલશે, જેમાં શેર હોલ્કર / સભાસદ વિભાગ અંતર્ગત લોગ-ઇન નો આઇક્રોન ખુલશે અને નવી સ્ક્રીન ખુલશે. આપે આપનો યુઝર આઇકી (આપના એનએસડીએલમાં ધારણ કરેલ ડિમેટ એકાઉન્ટનો ૧૬ આંકડાનો ડિમેટ નંબર, પાસવર્ડ / ઓટીપી અને સ્ક્રીનમાં દર્શાવિલ એક વેરીફીકેશન કોડ નાખવાનો રહેશે). સફળતાપૂર્વક ઓથેન્ટીકેશન કર્યા બાદ આપને એનએસડીએલ કિપોઝીટરીની વેબસાઈટ ઉપર લઈ જવામાં આવશે, જ્યાં આપ ઈ–વોર્ટીંગ પેજ જોઈ શક્શો. કંપની નામ અથવા ઈ-વોર્ટીંગ સર્વિસ પ્રોવાઈકરના નામ ઉપર ક્લીક કરવાથી આપને ઈ-વોર્ટીંગ સર્વિસ પ્રોવાઈકરની વેબસાઈટ ઉપર લઈ જશે જ્યાં આપ આપનો વોટ રીમોટ ઈ-વોર્ટીંગ દરમ્યાન અથવા વર્ચ્યુઅલ સભામાં જોડાઈ અને સભા દરમ્યાન

આપ ઈ-વોટીંગ સુવિદ્યા માટે આપના કિપોઝીટરી પાર્ટીશીપન્ટ એનએસકીએલ / સીકીએસએલ સાથે રજીસ્ટર્ક થઈ કિયોઝીટરી પાર્ટીશીપન્ટ્સ આપના ડિમેટ એકાઉન્ટના લોગ–ઈન ક્રેકેન્શીયલનો ઉપયોગ કરી લોગ–ઈન કરી શકો છો. સફળતાપૂર્વક લોગ–ઈન દ્વારા લોગ-ઈન કર્ચા બાદ આપ ઈ-વોર્ટીંગ વિકલ્પ જોઈ શકો છો. એકવાર તમે ઈ-વોર્ટીંગ વિકલ્પ ઉપર ક્લીક કરશો તો એ તમને એનએસડીએલ / સીડીએસએલ કિપોઝીટરીની સાઈટ ઉપર સફળતાપૂર્વક ઓથેન્ટીકેશન કરાવશે, જયાં તમે ઈ-વોટીંગના ફીચર્સ જોઈ શકશો. કંપનીનું નામ અથવા ઈ-વોટીંગ સર્વિસ પ્રોવાઈડરના નામ ઉપર ક્લીક કરવાથી તે કરનાર (ડિમેટ સ્વરૂપમાં શેર તમને ઈ-વોર્ટીંગ સર્વિસ પ્રોવાઈકરની વેબસાઈટ ઉપર લઈ જશે, જ્યાં તમે રીમોટ ઈ-વોર્ટીંગ સમયગાળા દરમ્યાન વ્યક્તિગત તમારો વોટ આપી શક્શો અથવા વર્ચ્યુઅલ સભામાં જોડાઈ શક્શો અને સભા દરમ્યાન વોટ આપી શક્શો.

૨. જે સભાસદો પોતાનો યુઝર આઈડી /પાસવર્ક ભુલી ગયા હોય તો તેઓ તેને પરત મેળવવા માટે ઉપર દર્શાવેલ વેબસાઈટમાં ફરગોટ યુઝર આઈડી અને ફરગોટ પાસવર્ડ નો વિકલ્પ ઉપર ઉપલબ્ધ છે.

સ્ટેપ ૨ : કિમેટ સ્વરૂપમાં વ્યક્તિગત સિવાયના સભાસદો માટે સીકીએસએલ ઈ-વોર્ટીંગ સિસ્ટમ દ્વારા ઉપયોગ કરવાની બાબતે :

સભાસદો (એચયુએફ સઢીત) વ્યક્તિગત સિવાયના સભાસદો માટે ઈ-વોર્ટીંગ માટે લોગ-ઈનની સૂચનાઓ : (૧) ઈ-વોર્ટીંગ વેબસાઈટ <u>www.evotingindia.com</u> પર લોગ-ઈન કરો.

શેરહોલ્ડર્સના ટેબ ઉપર ક્લીક કરવું.

હવે તમારો ચુઝર આઈડી લખો,

• સીડીએસએલ માટે : ૧૬ આંકડાનો બેનીફીશીયરી આઈડી લખો.

 એનએસડીએલ માટે: ૮ અક્ષરનો ડીપી આઈડી પછી ૮ આંકડાનો ક્લાયન્ટ આઈડી લખો. (૪) ત્યારબાદ સ્ક્રીન ઉપર દેખાતી ઈમેજ લખીને વેરીફીકેશન કરો અને લોગ-ઈન ઉપર કલીક કરો.

જો તમે શેર કિમેટ સ્વરૂપમાં ધારણ કરતા હોવ અને <u>www.evotingindia.com</u> પર લોગ-ઈન કરેલ હોય અને અગાઉ કોઈપણ કંપની માટે વોટીંગ કરેલ હોય તો પછી તમે તે જ પાસવર્ડ વાપરીને ઈ-વોટીંગ કરી શક્શો.

સ્થળ : નોઈડા તારીખ : ઓગસ્ટ ૧૦, ૨૦૨૩

### (ક) જો તમે પહેલીવાર ઉપયોગ કરી રહ્યા હોવ તો નીચેના પ્રમાણે અનુસરો.

	• •	
		ક્રિગેટ સ્વરૂપમાં વ્યક્તિગત સિવાયના સભાસદો માટે
	ันเ <b>ต</b> *	આથકર વિભાગ તરફથી જારી કરવામાં આવેલ આપનો ૧૦ આંકડાનો આલ્ફા-ન્થુમેરીક પાન નંબર દર્જ કરો. (કિમેટ સ્વરૂપમાં શેર ઘરાવનાર શેરઘારકોને લાગુ પડશે.)
		જે સભાસદોએ કંપની / ડિપોઝીટરી પાસે પાન નંબર રજીસ્ટર નથી કરાવ્યો તેમને વિનંતી કે તેઓ કંપની/આરટીએ દ્વારા મોકલેલ ક્રમાંક નંબરનો ઉપયોગ કરવો અથવા કંપની/આરટીએ નો સંપર્ક કરવો.
	કિવિકન્ડ બેંકની વિગતો અથવા	લોગ-ઈન કરવા માટે કંપનીમાં અથવા ડિમેટ એકાઉન્ટમાં રજીસ્ટર કરાવેલ બેંકની વિગતો અથવા તમારી જન્મ તારીખ dd/mm/yyyy ના ફોર્મેટમાં લખો.
	જન્મ તારીખ	જો આ બન્ને વિગતો ડિપોઝીટરી અથવા કંપની પાસે નોંધાવેલ ન ક્ષેત્ર તો ડિવિડન્ડ બેંકની વિગતોમાં આપનો સભાસદ આઈડી/ફોલીથો નંબર લખો.

આ દરેક વિગતો વ્યવસ્થિત દર્જ કર્યા પછી સબમીટ ટેબ ઉપર ક્લીક કરો.

- જે સભાસદો કિમેટ સ્વરૂપમાં શેરદારણ કરે છે તેઓ પાસવર્ક ક્રિએશન મેનુ ઉપર પહોંચશે. ત્થારબાદ તેમને નવા પાસવર્ક ખાનામાં લોગ–ઈન પાસવર્ડ ફરજીયાત દર્જ કરવાનો રહેશે. સભાસદોએ ધ્યાનમાં રાખવાનું કે આ પાસવર્ડ કિમેટ શેરધારકો કોઈ કંપની કે જેમણે સીકીએસએલ ના પ્લેટફોર્મ ઉપર ઈ-વોટીંગ પ્રક્રીયા શરૂ કરેલ હોય તે દરેક કંપનીના વોટીંગ રીઝોલ્યુશનમાં વોટ કરવા માટે વાપરી શકશે. આ આગ્રહભરી વિનંતિ કે આપનો આ પાસવર્ડ કોઈપણ અન્ય વ્યક્તિને જણાવવો નહીં અને આ પાસવર્ડને સાચવીને ગપ્ત રહે તેની તકેદારી રાખવી.
- (૯) ઈપીએસએન ઉપર ક્લીક કરી જરૂરી (કંપનીના નામ) કે જેને માટે તમારે વોટ આપવાનો છે તેને પસંદ કરો.
- (૧૦) વોર્ટીંગ પેજ ઉપર તમે જોશો ''રી.એલ્યુશન કિસ્કીપ્શન'' અને તેની સામે હા / ના વિકલ્પ વોર્ટીંગ માટે હશે. તમને જેને પસંદ કરવું હોય તેની સામે હા કે ના નો વિકલ્પ પસંદ કરો. વિકલ્પ હા એટલે તમે રી.એલ્યુશનને સહમત છો અને ના એટલે તમે રી.એલ્યુશનને
- (૧૧) જો તમારે રીઝોલ્યુશનની સંપૂર્ણ વિગતો જાણવી હોય તો ''રીઝોલ્યુશન ફાઈલ લિંક'' ઉપર ક્લીક કરો.
- (૧૨) રીઝોલ્યુશન પસંદ કરીને વોટ આપ્યા પછી સબમીટ ઉપર ક્લીક કરો. કન્ફરમેશનનું બોક્સ દેખાશે. જો તમારે વોટ કન્ફર્મ કરવો હોય તો ઓકે ઉપર કલીક કરો અન્યથા જો તમારે વોટ બદલવો હોય તો કેન્સલ ઉપર કલીક કરો અને તે પ્રમાણે તમારા વોટમાં ફેરબદલ કરો.
- (૧૩) એકવાર રીઝોલ્યુશન ઉપર વોટ કન્ફર્મ કર્યા પછી તમને તમારા વોટમાં ફેરબદલ કરવાની અનુમતિ નથી.
- (૧૪) તમે વોટીંગ પેજના વિકલ્પમાં જઈ કલીક ઢીચર ટુ પ્રીન્ટ ઉપર કલીક કરી રીઝોલ્યુશન ઉપર કરેલ તમારા વોટીંગની પ્રીન્ટ આઉટ
- (૧૫) જો તમે કિમેટ એકાઉન્ટ ઘારક હોવ અને તમારો પાસવર્ડ બદલવાનું ભુલી ગયા હોવ તો યુઝર આઈકી દર્જ કરી ઈમેજ વેરીફીકેશન કોર્ડ લખી ફરગોટ પાસવર્ડ ઉપર કલીક કરી સિસ્ટમ દ્વારા માંગેલ જરૂરી વિગતો દર્જ કરવાથી મેળવી શકાશે.
- (૧૬) બીઆર / પાવર ઓફ એટર્ની અપલોડ કરવાનો વિકલ્પ આપેલ છે અને જો તે અપલોડ કરેલ ફોય તો તે સ્કુટીનાઈઝર પાસે વેરીફીકેશન કરાવવાની સુવિધા ઉપલબ્ધ છે.

<u>નોન-વ્યક્તિગત શેરધારકો અને કસ્ટોડીયન્સ માટે ફક્ત રીમોટ વોર્ટીંગ માટેની નોંધ</u>

સ્ટેપ-૧ નોન-વ્યક્તિગત સભાસદો (એટલે કે વ્યક્તિગત, એચયુએફ, એનઆરઆઈ વગેરે સિવાયના અન્ય) અને કસ્ટોડીયનોએ www.evotingindia.com પર લોગ-ઈન કરી અને પોતાને કોર્પોરેટ્સ મોડ્યુલમાં રજીસ્ટર કરાવવાનું રહેશે.

સ્ટેપ-ર કંપનીના સહી અને સિક્કાવાળુ રજીસ્ટ્રેશન ફોર્મ સ્કેન કરી તેને <u>helpdesk.evoting@cdslindia.com</u> પર ઈમેઈલ કરવાનું રહેશે. સ્ટેપ-3 લોગ-ઈન ની વિગતો મળ્યા પછી એડમિન લોગ-ઈન અને પાસવર્ડનો ઉપયોગ કરી સહમત યુઝર બનાવવાનો રહેશે. સહમત

યુઝર આ એકાઉન્ટ સાથે લિંક કરવાથી પોતાનો વોટ આપી શકશે. સ્ટેપ-૪ જે એકાઉન્ટ લિંક થયા હશે આ એકાઉન્ટનું લિસ્ટ સ્વયં જ મેપ થઈ જશે અને જો કોઈ ખોટી રીતે મેપ થયું હશે તેને કિ–લિંક પણ

સ્ટેપ-પ તેમને કસ્ટોડીયનની તરફેણમાં જારી કરેલ બોર્ડ ઓફ રીઝોલ્યુશન અને પાવર ઓફ એટર્ની ની રકેન કોપી પીડીએફ ફોર્મેટમાં

અપલોઠ કરવાની રહેશે અને સ્ફૂટીનાઈઝર તેની ચકાસણી કરશે. જો વ્યક્તિગત ટેબમાં વોટ આપેલ ક્ષેય અને સીકીએસએલ ઈ-વોર્ટીંગ સિસ્ટમમાં તે દસ્તાવેજ સ્કુટીનાઈઝ કરવા અપલોક ન કરેલ ક્ષેય તો તેવા નોન-વ્યક્તિગત સભાસદોને વિનંતિ કે તેમના જરૂરી બોર્ડ ઓફ રીઝોલ્યુશન અને ઓથોરાઈઝ લેટર ની કોપી સાથે તેના ઉપર ઓથોરાઈઝ્ડ સિગ્નેટરીની સહી કે જેની પાસે વોટ કરવાની સત્તા છે તેની સહી સાથે કંપનીની સભાના ૪૮ કલાક પહેલા secretarial@ghcltextiles.co.in ઉપર મોકલવાની રહેશે.

સભાસદો માટે એજીએમ ના દિવસે ઈ-વોટીંગ સિસ્ટમ દ્વારા વોટીંગ કરવા માટેની માફિતી નીચે મુજબ છે.

૧. એજીએમ ના દિવસે ઈ-વોર્ટીંગ કરવાની પ્રક્રીયાની માહિતી એ ઉપર જણાવેલ રીમોટ ઈ-વોર્ટીંગ પ્રક્રીયાની માહિતી મુજબ જ છે. ર. ઉપરોક્ત જણાવેલ ઈ-વોટીંગની માહિતી મુજબ સફળતાપૂર્વક લોગ-ઈન કર્યા બાદ વીસી / ઓએવીએમ સુવિંઘા દ્વારા ચોજાનાર

- સભામાં હાજર રહેવા માટેની લિંક કંપનીના ઈવીએસએનમાં ઉપલબ્ધ થશે.
- જે સભાસદે રીમોટ ઈ-વોર્ટીંગ દ્વારા વોટ આપ્યો હશે તે એજીએમમાં હાજર રહેવા લાયક ગણાશે પરંતુ તે એજીએમમાં વોટ આપવા લાયક ગણાશે નહીં.
- સભાસદોને સભાના સારા અનુભવ માટે લેપટોપ / આઈપેડ દ્વારા સભામાં જોડાવા વિનંતી છે.
- વધુમાં સભાસદોને સભા દરમ્યાન કોઈ વિઘ્ન ન આવે તે માટે સારી ઝકપ ઘરાવતા ઈન્ટરનેટ અને કેમેરાનો ઉપયોગ કરવા વિનંતી.
- સભાસદોને જણાવવાનું કે તેમના લેપટોપ કે ટેબલેટને મોબાઈલ કે મોબાઈલ કોટસ્પોટ દ્વારા કનેક્ટ કરતા મોબાઈલ નેટવર્કમાં ફલ્ક્ચ્યુએશનના કારણે જો ઓડીયો / વિડીયો માં આકસ્મિક ક્ષતિ કે લોસ થવાની સંભાવનાને લીઘે સ્ટેબલ વાઈફાઈ કે લેન કનેકશન વાપરવાની ભલામણ કરવામાં આવે છે.
- જે સભાસદોને સભા દરમ્યાન તેમના મંતવ્ય રજૂ કરવા કે કોઈ પ્રશ્ન પૂછવો હોય તો તેણે સભાની તારીખના હ દિવસ પહેલા પોતાનુ નામ, ડીમેટ એકાઉન્ટ નંબર, ફોલીયો નેંબર, ઈમેઈલ આઈડી, મોબાઈલ નંબર વિગેરે કંપનીના ઈમેઈલ આઈડી secretarial@ghcl.co.in ઉપર મોકલી પોતાનું નામ સભામાં સ્પીકર તરીકે નોંધાવવાનું રહેશે. સભાસદને એજીએમ દરમ્યાન બોલવું નથી પરંતુ કોઈ પ્રશ્ન હોય તો સભાસદે તેનો પ્રશ્ન સભાની તારીખના ७ દિવસ પહેલા પોતાનુ નામ, ડીમેટ એકાઉન્ટ નંબર, ફોલીથો નંબર, ઈમેઈલ આઈડી, મોબાઈલ નંબર વિગેરે કંપનીના ઈમેઈલ આઈડી secretarial@ghcltextiles.co.in ઉપર મોકલવાનો રહેશે. આ પ્રશ્નનો જવાબ કંપનીને અનુફૂળ આવે તે રીતે ઈમેઈલ દ્વારા આપવામાં આવશે.
- ૮. જે સભાસદોએ તેમનું નામ સ્પીકર તરીકે નોંધાવેલ હોય તેઓને સભા દરમ્યાન ફક્ત તેમના મંતવ્ય રજૂ કરવાની કે પ્રશ્ન પુછવાની મંજૂરી
- ફક્ત તે જ સભાસદી / સભાસદી જે એજીએમમાં વીસી / ઓએવીએમ સુવિધા દ્વારા હાજર હશે અને જેમણે રીઝોલ્યુશન ઉપર રીમોટ ઈ—વોટીંગ દ્વારા પોતાનો વોટ નહીં આપ્યો હોય કે તેમ કરતા તેમને રોક્યા ન હોય તેઓ એજીએમ ના દિવસે રીમોટ ઈ—વોટીંગ સિસ્ટમની સુવિધા દ્વારા વોટ આપવા માટે લાયક ગણાશે.
- ૧૦. જો કોઈ સભાસદે એજીએમ ના દિવસે રીમોટ ઈ-વોટીંગ દ્વારા વોટ આપ્યો હશે અને જો તે સભાસદ વીસી / ઓએવીએમ સુવિધા દ્વારા ચોજાયેલ સભામાં ભાગ લીધો નહીં હોય તો આ સભાસદ દ્વારા કરેલ વોટને રદબાતલ ગણાશે. કેમકે ઈ-વોટીંગની સુવિધા ફક્ત તે જ સભાસદ માટે ઉપલબ્ધ છે જેમણે સભામાં ભાગ લીધેલ હશે.
- ૧૧. જે સભાસદે રીમોટ ઈ-વોટીંગ દ્વારા વોટ આપ્યો કશે તે એજીએમમાં ફાજર રહેવા લાયક ગણાશે પરંતુ તે એજીએમમાં વોટ આપવા

સભાસદો માટે વીસી / ઓએવીએમ દ્વારા થોજાનાર એજીએમ માં ભાગ લેવા માટે માફિતી નીચે મુજબ છે.

- ૧. સભાસદોને વીસી/ઓએવીએમ દ્વારા યોજાનાર એજીએમ માં ભાગ લેવા માટેની સુવિધા સીડીએસએલ ઈ-વોર્ટીંગ સિસ્ટમ દ્વારા પૂરી પડાશે. સભાસદ https://www.evotingindia.com દ્વારા સભાસદ / સભાસદ લોગ-ઈન ફેઠળ રીમોટ ઈ-વોર્ટીંગ કેડેન્શીયલનો ઉપયોગ કરી લોગ-ઈન કરી શકશે. શેરધારકો/સભાસદોને વીસી/ઓએવીએમ લોગ-ઈન ની લિંક કંપનીના ઈવીએસએન ઉપર કિસ્પલે કરાશે. ર. સભાસદોને વિનંતી કે સભાનો સારો અનુભવ મેળવવા લેપટોપ કે પર્સનલ કોમ્પ્યુટરનો ઉપયોગ કરવો.
- 3. વધુમાં, સભાસદોએ સભા દરમ્યાન કેમેરાનો ઉપયોગ મંજૂર કરવાનો તેમજ કોઈપણ બાધા ન આવે તે માટે સારી સ્પીકવાળા ઈન્ટરનેટનો
- ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે. ૪. એની નોંધ લેવી કે ભાગ લેનાર સભાસદ જો મોબાઈલ અથવા ટેબલેટ અથવા લેપટોપને મોબાઈલ હોટસ્પોટ દ્વારા કનેક્ટ કરશે અને તેમને ઓડીયો વ્યુઝ્યુઅલ લોસ કે તેમના નેટવર્કમાં ફ્લક્ચ્યુએશન આવી શકે છે. આથી તેમને સલાહ આપવાની કે તેઓ ઉપરોક્ત અસવિદ્યાઓ ટાળવા વાઈ-કાઈ કે લેન નો ઉપયોગ કરે.
- પ. સભાસદો કે જેમને સભા દરમ્થાન તેમના વ્યું કે કોઈ સવાલ પૂછવો હોય તેમને રપીકર તરીકે તેમના નામ, ડિમેટ એકાઉન્ટ નંબર / ફોલીયો નંબર, ઈ–મેઈલ આઈડી, મોબાઈલ નંબર સાથેની રીકવેસ્ટ સભાના ७ દિવસ પહેલા <u>secretarial@ghcltextiles.co.in</u> મોકલીને સ્પીકર તરીકે રજીસ્ટર્ડ કરાવવાનું રહેશે. ફક્ત તે જ સભાસદો જેમને તેમનું નામ રજીસ્ટર્ડ કરાવ્યું હશે તેમને જ સભા દરમ્યાન પોતાનો વ્યુ કે સવાલ પૂછવાની મંજૂરી આપવામાં આવશે.
- ૬. કંપની દ્વારા સભાસદોને ભાગ લેવા માટે ટુ-વે ટેલી કોન્ફરન્સીંગ ની સુવિધા અથવા વેબએક્સ પૂરી પાડવામાં આવશે. સભાની રેકોર્ડ કરેલ ટ્રાન્સકીપશન કંપનીની વેબસાઈટ ઉપર અપલોડ કરવામાં આવશે અને તે પણ કંપની દ્વારા સેફ કસ્ટડીમાં મેઈન્ટેઈન કરવામાં આવશે. ઈ-વોર્ટીંગને લગતી સહાયતા / સમસ્થા માટે :

લોગ-ઈનનો પ્રકાર	
સીકીએસએલ	٩
પાસે કિમેટ	
સ્વરૂપમાં	
શેર ઘરાવનાર	
વ્યક્તિગત	ş
સભાસદો	`

**હેલ્પ કેસ્કની વિગતો** . સભાસદોને ઈ–વોર્ટીંગને લગતી કોઈ પૂછપરછ અથવા સમસ્યાઓ કે ફરિયાદો હોય તો તેઓ વેબસાઈટ www.evotingindia.com પર ઉપલબ્ધ "ફેલ્પ સેકશન" ફેઠળ આપેલા "ફ્રીક્વન્ટલી આસ્કડ કવેશ્યન્સ' ("FAQs") જોઈ શકે છે અને ઈ-વોર્ટીંગ મેન્યુલ વાંચી શકે છે અથવા <u>helpdesk.evoting@cdslindia.com</u> પર ઈ–મેઈલ પણ મોકલી શકે છે અથવા ટોલ ફ્રી નંબર : ૧૮૦૦૨૨૫૫૩૩ નો સંપર્ક કરવો.

ઈલેક્ટ્રોનિક વોટીંગને સુવિધાઓને લગતી બધી જ ફરીયાદો માટે શ્રી રાકેશ દલ્વી, સિનિયર મેનેજર (સીડીએસએલ) સેન્ટ્રલ કિપોઝીટરી સર્વિસીસ (ઇન્ડીયા) લિમીટેડ, એ વિંગ, ૨૫મો માળ, મેરેથોન ફ્યુચરેક્ષ, મફતલાલ મિલ ક્રમ્પાઉન્ક્સ, એન. એમ. જોશી માર્ગ, લોઅર પરેલ (પૂર્વ), મુંબઈ-૪૦૦૦૧૩ અથવા ઈ-મેઈલ helpdesk.evoting@cdslindia.com કરો અથવા ટોલ ફ્રી નંબર : ૧૮૦૦૨૨૫૫૩૩ નો સંપર્ક કરવો.

### એનએસડીએલ પાસે કિમેટ સ્વરૂપમાં શેર ઘરાવનાર વ્યક્તિગત સભાસદે

હેલ્પકેસ્ક <u>evoting@nsdl.co.in</u> ઉપર ઈ-મેઈલ મોકલી શકે છે અથવા ટોલ ફ્રી નં. ૧૮૦૦૧૦૨૦૯૯૦, જે સભાસદો ઇલેક્ટ્રોનીક સ્વરૂપમાં શેર ધરાવતા હોય તેમણે તેમના રજીસ્ટર્ક સરનામા, બેંકની વિગતો, ઈ–મેઈલ આઈકી વગેરેમાં કોઈ

જો સભાસદને લોગ–ઈન કરવામાં કોઈ ટેકનીકલ સમસ્યા આવતી હોય તો તેમણે એનએસડીએલના

સુધારો હોય તો તેમણે આ સુધારા માટે તેમના કિપોઝીટરી પાર્ટીશીપન્ટનો સંપર્ક કરવો.

શ્રી મનોજ આર. લુકંત, પ્રેક્ટીર્શીંગ કંપની સેંક્રેટરીને જેમનો મેમ્બરશીપ નંબર F4287 અને સર્ટીફીકેટ પ્રેક્ટીર્શીંગ નંબર 2574 છે તેમને રીમોટ ઈ–વોટીંગ પ્રક્રીચામાં ઈ–વોટીંગ કામગીરીની પારદર્શક તથા ન્યાચી યોકસાઈ અને વર્ગીકરણ માટે સ્કુટીનાઈન્ડર તરીકે નિચુકત કરવામાં આવ્યા છે. બોર્ડ દ્વારા કેએમપી ને પણ શ્રી હુર્કત સાથે / અથવા તેમના સ્થાને એક અથવા વધારાના સ્કુટીનાઈઝર તરીકે અધિકૃત કરવામાં આવ્યા છે. આ સ્ક્રુટીનાઈઝર સાધારણ સભામાં મતદાન પુરૂ થયા પછી તરત પ્રથમ સભામાં પહેલા મતોની ગણતરી કરશે. સૌ પ્રથમ સભામાં થયેલ મતોની ગણતરી થશે ત્યારબાદ સભા પૂર્ણ થયાના મોડામાં મોડા બે દિવસની અંદર કંપનીના કર્મચારી ના હોય તેવા બે વ્યક્તિની સાક્ષીમાં રીમોટ ઈ-વોટીંગ દ્વારા કરવામાં આવેલા મતદાનના મતોની ગણતરી થશે અને દરખાસ્તોની તરફેણ અને વિરૂધ્ધમાં પડેલા કુલ મતોનો સ્કુટીનાઈઝરનો સંગઠીત અફેવાલ જો કોઈ દશે તો તે કંપનીના અધ્યક્ષ અથવા તેમના દ્વારા અધિકૃત કરવામાં આવેલી વ્યક્તિને સોંપશે. જેઓ પણ તે અફેવાલ ઉપર પોતાના હસ્તાક્ષર કરશે. ત્થારબાદ અધ્યક્ષ અથવા તેઓના દ્વારા અધિકૃત કરેલી વ્યક્તિ લેખિતમાં મતદાનનું પરિણામ જાહેર કરશે.

સભા પૂરી થયા બાદ તુરંતજ ચેરમેનશ્રી દ્વારા સ્કૂટીનાઈઝરનો અહેવાલ તેમજ જારી કરવામાં આવેલ નાણાકીય પરિણામો કંપનીની વેબસાઈટ (www.ghcltextiles.co.in) અને સીડીએસએલ ની વેબસાઈટ ઉપર મૂકવામાં આવશે અને આ નાણાકીય પરિણામો વિશે સ્ટોક એક્ષચેન્જને પણ માહિતગાર કરાશે.

સભાસદોને જો કોઈ પૂછપરછ ફોય તો તેઓને ઓછામાં ઓછા સભાના ૭ દિવસ પહેલા મોકલી આપવા વિનંતી છે, જેથી તે માફિતી સભા વખતે ઉપલબ્ધ કરાવી શકાય. જીએચસીએલ ટેક્ષટાઈલ્સ લિગીટેક વતી સફી/- લલીત નારાષણ દ્વીવેદી કેપની સેક્રેટરી

મેમ્બરશીપ નંબર : F10487





















